



**સુરત મહાનગરપાલિકા**  
**વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ**

**આર. ટી. આઈ. એક્ટ – ૨૦૦૫**

**પ્રો. એક્ટીવ ડીસ્ક્લોઝર**

**૨૦૨૪**

**(તા.૦૧/૦૫/૨૦૨૪ ની સ્થિતીએ)**

ઓફિસ :-

ખજોદ-ભીમરાડ સંકલિત વોર્ડ ઓફિસ,  
મેટ્રો મોલની પાછળ, કસ્ટમ ઓફિસની બાજુમાં,  
ભીમરાડ, સુરત-૩૯૫ ૦૦૭.

જંતુનાશક અધિકારી  
અને જાહેર માહિતી અધિકારી  
વી.બી.ડી.સી વિભાગ  
સુરત મહાનગરપાલિકા.

કલમ-૪ (૧) (ખ)(૧)

પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો :-

- સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે.

કલમ-૪ (૧) (ખ)(૨)

પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો:-

**જંતુનાશક અધિકારી :-**

ભારત સરકારશ્રીનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત નેશનલ નોડલ સંસ્થા એન.વી.બી.ડી.સી.પી. અને એન.સી.ડી.સી.ની તથા રાજ્ય કક્ષાએથી વેક્ટર બોર્ન ડીસીઝની ગાઈડલાઈન, માર્ગદર્શક સુચનો અનુસાર શહેરી વિસ્તારો માટે વાહક જન્ય રોગ નિયંત્રણની કામગીરી ડે.કમિશનરશ્રી(હેલ્થ અને હોસ્પિટલ) તથા આરોગ્ય અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન મુજબ તાંત્રિક અને વહીવટી બાબતો અંગે આયોજન, અમલીકરણ, દેખરેખ અને માર્ગદર્શન મુજબ કામગીરી કરવાની રહેશે.

1. ભારત સરકાર અને રાજ્ય સરકારશ્રી તરફથી યોજાતી મિટીંગો, વર્કશોપ તથા કાર્યશિબીરોમાં હાજરી આપવી અને તેમની ગાઈડલાઈન અનુસાર વાહક જન્ય રોગ નિયંત્રણની કામગીરીનો વખતો વખતના સુધારાત્મક નિતીઓ, અભિગમો વગેરેનો અમલ કરાવવો.
2. શહેરી વિસ્તારોમાં વાહક જન્ય રોગોનું તાંત્રિક અને વૈજ્ઞાનિક ઢબે અમલીકરણ પ્રવૃત્તિઓ સુચારૂ રીતે કરાવવા જંતુનાશક અધિકારીના વડપણ હેઠળ અધિક જંતુનાશક અધિકારી અને દરેક ઝોનના આસી.જંતુનાશક અધિકારી દ્વારા હાથ ધરાય તે જોવાની સીધી જવાબદારી વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગનાં વડાની રહેશે.
3. વાહક જન્ય રોગોના અટકાવ અને નિયંત્રણ માટે ભારત સરકાર, રાજ્ય સરકાર તેમજ WHO દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ સ્પેશીફિકેશન મુજબની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી અસરકારક જંતુનાશક દવાઓ અને લાર્વીસાઈડસ દવાઓ સમયસર ઉપલબ્ધ કરાવી અને પુરી પાડવાની રહેશે.
4. વાહક જન્ય રોગોનાં સચોટ નિદાન અને સારવાર માટે જરૂરી અને જીવનરક્ષક દવાઓ તથા પ્રાયોગિક પરિક્ષણો માટે જરૂરી એવી તમામ સાધન સામગ્રી અને વિશિષ્ટ ઉપકરણો ઉપલબ્ધ કરાવવા અને પુરા પાડવાના રહેશે.
5. શહેરની વસ્તી અને વાહક જન્ય રોગોનું ભારણ ધ્યાને રાખીને મુદ્દા નં. ૩ અને ૪ તથા વાહક જન્ય રોગોનાં અમલીકરણ માટે જરૂરી મેન પાવર તથા બજેટની જોગવાઈ અને નિયમોનુસાર ખર્ચ કરી નાણાકીય અને ભૌતિક સિધ્ધિઓ પ્રાપ્ત કરવાની રહેશે.
6. વાહક જન્ય રોગોમાં ઉદભવતા રોગચાળાઓ કે કેસોમાં અસાધારણ વધારો નિયંત્રિત કરવા રોગચાળો ઉગતો જ ડામી દેવાની પૂર્વ તૈયારીઓ અને તેનો વહેલાસરનો પ્રતિભાવ આપવા યુધ્ધના ધોરણે લેવાના થતા પગલાઓનું આયોજન કરાવવાનું રહેશે. આ અંગે વિવિધ ખાતાઓનું સંકલન, સામેલગીરી અને સહકાર મ્યુનિસીપલ કમિશનરશ્રીના અધ્યક્ષપણા હેઠળ કેળવવાનો રહેશે.
7. ઉપરી અધિકારી તરફથી સોપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

## **એડીશનલ જંતુનાશક અધિકારી :-**

1. ખાતાની કામગીરીમાં જોડાયેલ દરેક કર્મચારીના હોદ્દા મુજબ ફરજો અને જવાબદારીઓની સોંપણી કરી નક્કી કરેલ કાર્યયોજના (Action Plan) મુજબ પ્રવૃત્તિઓ અને પેટા પ્રવૃત્તિઓની કામગીરી અને તેની સિદ્ધિઓ નક્કી કરેલ માપદંડ મુજબ અદા કરાવવાની રહેશે.
2. શહેરી વિસ્તારોની રચનાને ધ્યાને રાખી મેલેરીયા, ફાઈલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા જેવા રોગોનું સર્વેલન્સ અઠવાડિક/પખવાડિક ધોરણે હાથ ધરાવી રોગોનું ભારણ ઘટાડવા જુદા જુદા વાહકો જેવા કે, મચ્છર, રેટફ્લી, સેન્ડફ્લાઈને અસરકારક પગલાઓ લઈને અંકુશ હેઠળ રાખવાના રહેશે.
3. ઝોનમાંથી જંતુનાશક દવાની ડિમાન્ડ મંગાવવી, આ ડિમાન્ડના આધારે જંતુનાશક દવા ખરીદી કરવા અંગે ટેન્ડર તૈયાર કરવા તથા વર્તમાનપત્રોમાં નોટીસ આપવી. જંતુનાશક દવાના ભાવ મંજૂર કરાવવા દરખાસ્ત બનાવવી, જંતુનાશક દવાના સેમ્પલ ટેસ્ટીંગ કરાવવા, ઝોનમાં દવાની ફાળવણી, પાર્ટીના પેમેન્ટ અંગેની કાર્યવાહી કરવી, સિક્યોરીટી ડિપોઝીટ રિલીઝ કરવાની કાર્યવાહી વિગેરે.
4. વાહક જન્ય રોગોના અટકાવ અને નિયંત્રણ માટે ભારત સરકાર, રાજ્ય સરકાર તેમજ WHO દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ સ્પેશીફિકેશન મુજબની ઉચ્ચ ગુણવત્તા ધરાવતી અસરકારક જંતુનાશક દવાઓ અને લાર્વીસાઈડસ દવાઓ સમયસર ઉપલબ્ધ કરાવી અને પુરી પાડવાની રહેશે.
5. જંતુનાશક દવાઓના ખાલી ટીન બેરલ/ભંગાર વિગેરે સ્કેપ કરી ટેન્ડરથી વેચાણ કરાવવું.
6. અન્ય સાધન સામગ્રી જેવી કે હેન્ડ કોમ્પ્રેસર પંપ, બેટરી સેલ વિગેરે ખરીદવાની કાર્યવાહી કરવી.
7. ફોગીંગ મશીનો તથા માઈક્રોસ્કોપ સર્વિસ/રીપેરીંગ કરાવવાની કાર્યવાહી કરવી.
8. તમામ ઝોન /ઓવરઓલ મોનીટરીંગ અને સુપરવિઝનની કામગીરી કરવાની રહેશે.
9. વી.બી.ડી.સી. સ્ટોર અને સર્વેલન્સ વર્કરને લગતી તમામ કામગીરી કરવાની રહેશે.
10. હેડક્વાર્ટર એન્ટોમોલોજીકલ એક્ટીવીટી, પ્લેગ સર્વેલન્સ યુનિટની કામગીરી કરવાની રહેશે.
11. મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયા રીપોર્ટીંગ તેમજ લેબોરેટરીની મોનીટરીંગની કામગીરી કરવાની રહેશે.
12. ઉપરી અધિકારી તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

## **આસી.જંતુનાશક અધિકારી :-**

- (૧) આસી.જંતુનાશક અધિકારી તેમને આપવામાં આવેલ ઝોનમાં થતી કામગીરી માટે જવાબદાર છે.
- (૨) આસી.જંતુનાશક અધિકારીએ જે તે વિસ્તાર તેમજ રોજબરોજની કામગીરીથી માહિતગાર થવા ઉપરાંત તેમણે ઈન્સેક્ટીસાઈડ ઓફિસરની સુચનાઓનો પણ ત્વરિત અમલ કરવાનો રહેશે.
- (૩) તેમને આપવામાં આવેલ વિસ્તાર તેમજ પોતાની ફરજથી માહિતગાર થવું એ એમની પહેલી ફરજ છે, તેમજ તેમના વિસ્તારમાં રોજ બરોજની કામગીરી અને મેલેરીયા-ફાઈલેરીયા રોગની એપીડેમિયોલોજીથી તરત જ માહિતગાર થવાનું હોય છે.
- (૪) કામગીરી માટે કર્મચારીઓને બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે. (અ) વહીવટી (બ) ક્ષેત્રીય કામગીરી માટે, ફાઈલેરીયા/મેલેરીયા ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર, પ્રાયમરી હેલ્થ વર્કર, ફીલ્ડ વર્કર અને ડ્રાય વરનો સમાવેશ ક્ષેત્રીય સ્ટાફમાં થાય છે. તે તમામ સ્ટાફ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે તે જોવાનું રહેશે.
- (૫) વિસ્તારમાં ઘરોની સંખ્યા, વિસ્તારમાં વસતા લોકોની સંખ્યા તેમજ પ્રકાર અને જે તે વિસ્તારમાં મળતા કાયમી અને બિનકાયમી બ્રિડીંગના આધારે જે તે વિસ્તારમાં આસી.જંતુનાશક અધિકારી તેમને સોંપવામાં આવેલ વિસ્તારમાં ફરજ પર મુકવામાં આવતા યુનિટની સંખ્યા, દરેક યુનિટ પર પ્રાયમરી હેલ્થ વર્કરની સંખ્યા અને ફિલ્ડ વર્કરની સંખ્યા રાષ્ટ્રીય નોર્મસને ધ્યાને રાખી નક્કી કરવાનું રહેશે.
- (૬) ટીમ લીડર તરીકે આસી.જંતુનાશક અધિકારી પોતાના વિસ્તારમાં કાર્યરત દરેક વર્કરને રૂબરૂ ઓળખતા હોવા જરૂરી છે, તેમજ તેમને સોંપેલ કામગીરી સારી રીતે પુરી પાડે એ માટે એમને સાચું માર્ગદર્શન પુરુ પાડી એમનો આત્મવિશ્વાસ વધારે એ જરૂરી છે.
- (૭) ફિલ્ડમાં કાર્યરત દરેક મેલેરીયા/ફાઈલેરીયા ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર, મેલેરીયા સર્વેલન્સ વર્કર, ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વેલન્સ વર્કર, પ્રાયમરી હેલ્થ વર્કર પાસે વર્કડાયરી રખાવવાની રહેશે, જેમાં દરરોજની કામગીરીની નોંધ રાખે છે કે કેમ તે જોવાની જવાબદારી રહેશે તેમ જ જ્યારે તેમના ઉપરી અધિકારી જોવા માંગે ત્યારે એમને બતાવવાની રહેશે.
- (૮) આસી.જંતુનાશક અધિકારીએ તેમના વિસ્તારની દરરોજની કામગીરી, અઠવાડિક કામગીરી અને મંથલી કામગીરીના રીપોર્ટ અંગેના શિડયુલ્ડ બનાવીને સમય મર્યાદામાં તૈયાર કરાવી તેમના કાયમી રેકોર્ડ સાચવવાના રહેશે.
- (૯) આસી.જંતુનાશક અધિકારીએ પોતાના વિસ્તારમાં થતી કામગીરી અંગેની માહિતી ઈન્સેક્ટીસાઈડ ઓફિસર(વાહક જન્ય રોગ)ને પુરી પાડીને સમગ્ર શહેરની કામગીરી કરવામાં મદદરૂપ થવાનું રહેશે.
- (૧૦) એન્ટીલાવલ કામગીરી કરનારા, ફાઈલેરીયા મેલેરીયા ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટરોએ, આસી.જંતુનાશક અધિકારીની સીધી દેખરેખ હેઠળ કામગીરી કરવાની રહેશે.
- (૧૧) યુનિટ લેવેલે થતી વાહક જન્ય રોગોને નિયંત્રણ કરવાની તમામ કામગીરીથી વાકેફ થવાનું રહેશે. તેમણે સમયાંતરે સુચિત માપદંડોને આધારે વર્કર વાઈઝ અને વિસ્તારવાઈઝ મોનીટરીંગ અને મુલ્યાંકન કરવાનું રહેશે.
- (૧૨) મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયાના પોઝીટીવ કેસના વિસ્તારમાં તેમજ તેમની આસપાસના વિસ્તારમાં ઈન્ડોર સ્પેસ સ્પ્રે અથવા પ્રાયરેશોઈડ ફોગીંગની કામગીરી કરાવવી.
- (૧૩) કેમીકલ કંટ્રોલના વધુ ઉપયોગને બદલે એમણે જ્યાં શક્ય હોય ત્યાં બાયો એન્વાયરમેન્ટલ કંટ્રોલ મેઝર્સનો વધુ ઉપયોગ કરવાનો રહેશે. લાર્વા ભક્ષક માછલીઓ જેવી કે, ગંબુશીયા અને ગપ્પીની હેચરીઝ (Hatcheries) બનાવડાવવાની રહેશે.
- (૧૪) આસી.જંતુનાશક અધિકારીએ જે તે વિસ્તારના મચ્છરની દર છ મહિનાના અંતરે WHO લાર્વલ સસેપ્ટીબીલીટી ટેસ્ટ દ્વારા જે તે રોગના વાહક મચ્છરનું સસેપ્ટીબીલીટી સ્ટેટસ જંતુનાશક અધિકારીને જણાવવાનું રહેશે. આસી.જંતુનાશક અધિકારીએ ઈન્સેક્ટીસાઈડ ઓફિસરને કામગીરીના મંથલી ટેકનીકલ રીપોર્ટ તેમજ એન્યુઅલ રીપોર્ટ આપવાના રહેશે.
- (૧૫) ડોમેસ્ટીક તેમજ પેરીડોમેસ્ટીક કંટ્રોલ માટે કાયદાકીય નિયમો કડક રીતે લોકો દ્વારા પાડવામાં આવે એની તકેદારી આસી.જંતુનાશક અધિકારીએ રાખવાની રહેશે.

(૧૬) આસી.જંતુનાશક અધિકારીએ જે તે વિસ્તારમાં પ્રાયવેટ પ્રેક્ટીશનર, હોસ્પિટલ, ક્લિનિક તેમજ ડીસ્પેન્સરીના ડોક્ટર સાથે સંકલન કરી પેસીવ સર્વેલન્સની કામગીરી સઘન બનાવવાની રહેશે.

### **મેડીકલ ઓફિસર :-**

- (૧) મેડીકલ ઓફિસર સમગ્ર કામગીરીના માળખામાં Early case detection અને Complete treatment માટે અગત્યની ચાવી છે. મેડીકલ ઓફિસર આ અંગેની કામગીરી અર્થે સારી રીતે ટ્રેઈન થયેલા હોવા જોઈએ, તેમજ તેમનો સદર કામગીરીમાં સંપુર્ણ રસ હોવો જરૂરી છે.
- (૨) તેમણે આસી.જંતુનાશક અધિકારી સાથે મળી જે તે વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ વિઝીટ માટે પ્રાયમરી હેલ્થ વર્કરનો પખવાડિક શિડયુલ તૈયાર કરવાનો રહે છે.
- (૩) તેમણે દવા આપતા પહેલા તાવના દરેક કેસનો લોહીનો નમૂનો મેલેરીયા ટેસ્ટ માટે લેબોરેટરી માં મોકલવાનો રહેશે.
- (૪) તેમણે પોતાના વિસ્તારમાં આવેલ મેલેરીયા ક્લિનિક તેમજ હેલ્થ સેન્ટર પર લેવાનારા લોહીના નમૂનાની ગુણવત્તા, તેનું સ્ટેઈનિંગ તેમજ માઈક્રોસ્કોપીક એકઝામીનેશન બરાબર છે કે નહિ તેમજ લોહીના નમૂના દરરોજ સ્ટેઈન કરવામાં આવે છે કે નહિ એ ચેક કરવાનું રહેશે.
- (૫) તેમના વિસ્તારમાં આવેલ હેલ્થ સેન્ટર ઉપર ફરજ બજાવતા લેબોરેટરી ટેકનીશીયન K-7, 8 અને 9 રજીસ્ટર મેઈન્ટેઈન કરે છે ? તેમજ સબ સેન્ટરવાઈઝ અને પેસીવ એજન્સીવાઈઝ પ્લડ સ્મીયર કલેક્શન એકઝામીનેશન અને પોઝીટીવ કેસોના આંકડા દર્શાવતા ચાર્ટ તેમજ ગ્રાફ વ્યવસ્થિત રીતે ડીસપ્લે કર્યા છે કે નહિ એ જોવાની જવાબદારી મેડીકલ ઓફિસરની છે.
- (૬) પોઝીટીવ કેસને ૨૪ કલાકમાં રેડીકલ ટ્રીટમેન્ટ મળે એની તકેદારી રાખવાની રહેશે.
- (૭) મેલેરીયા કેસોને સારવાર અર્થે જરૂરી દવાઓનો જથ્થો પુરતો છે કે નહિ એ અંગેની તકેદારી મેડીકલ ઓફિસરે રાખવાની રહે છે.
- (૮) તેમણે પોતાના વિસ્તારમાં કાર્યરત મેલેરીયા ક્લિનિક અથવા અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત દરમ્યાન લેબોરેટરીમાં વપરાતા સાધનો જેવા કે, માઈક્રોસ્કોપ, ગ્લાસ સ્લાઈડ, સ્ટેઈન વગેરેની ચકાસણી કરવાની રહેશે.
- (૯) તેમણે ફિલ્ડ વિઝીટ દરમ્યાન ચકાસણી કરવાની રહેશે કે પ્રાયમરી હેલ્થ વર્કર મેલેરીયા કેસ ડિટેક્શન એમને જણાવ્યા મુજબની ગાઈડલાઈન અનુસાર કરે છે કે કેમ ?
- (૧૦) એપીડેમિયોલોજીકલ ઈન્વેસ્ટીગેશન માટે તેમણે જે તે વિસ્તારમાં થતી કામગીરીના ડેટાનું એનાલીસીસ કરી લેવાના અટકાયત પગલાં તેમજ રોગની આઉટબ્રેક થવાની પરિસ્થિતિ છે કે કેમ એ અંગેનું મોનીટરીંગ કરવાનું હોય છે.
- (૧૧) તેમણે પોતાના વિસ્તારમાં ડ્રગ ફેલિયર કેસનું મોનીટરીંગ કરી ઈન્સેક્ટીસાઈડ ઓફિસર (H.Q.)ને જાણ કરવી.
- (૧૨) મેલેરીયાના જટિલ અને સિવીયર કેસ કે જેની સારવાર હેલ્થ સેન્ટર ઉપર શક્ય ન હોય એવા કેસને મસ્કતિ, સ્મીભેર અથવા નવી સિવીલ હોસ્પિટલ જેવી સેન્ટીનલ હોસ્પિટલ ઉપર રીફર કરવા.
- (૧૩) મેલેરીયા પોઝીટીવ કેસોના રેકોર્ડ બરાબર મેઈન્ટેઈન થાય છે કે નહિ એની તકેદારી રાખવી.

### **સેક્શન ઓફિસર અને જાહેર માહિતી અધિકારી :-**

- વહીવટને લગતી તમામ કામગીરી કરાવવી.
- જંતુનાશક અધિકારી ધ્વારા મળતા સૂચનો/કામગીરીનો અમલ કરાવવો.
- જંતુનાશક દવાના ભાવ મંજૂર કરાવવા અંગેની દરખાસ્ત તૈયાર કરવી.
- મહેકમ/હાજરીપત્રકને લગતી કામગીરી કરાવવી.
- ઉપરી અધિકારી તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

- બીજી શ્રેણી સુધીના કલેરીકલ કેડરના પગાર અંગેના ઈજાર મંજૂર કરવા તેમજ બજેટમાં કરેલ જોગવાઈ મુજબ રજા, પ્રવાસ અંગેનો બીલો મંજૂર કરવા

### **હેડ ક્લાર્ક (પ્રથમ શ્રેણી ક્લાર્ક )**

- કચેરીનું હાજરીપત્રક જાળવણી કરી હાજરીપત્રકમાં હાજરીનું ચેકીંગ કરી કર્મચારીઓના રજા બાબતના શેરા હાજરીપત્રકમાં કરવા.
- પ્રોસીક્યુશન અને કોર્ટ કેસ અંગેની કામગીરી સંભાળવી.
- રાઈટ ટુ ઈન્ફોર્મેશન અંગેની કામગીરી સંભાળવી.
- ગુજરાત રાજ્ય સરકાર તરફથી અગર અન્ય સંસ્થાઓ તરફથી આવતા પત્રવ્યવહાર અંગેની કામગીરી કરવી.
- ડેડ સ્ટોક રજીસ્ટર મેઈન્ટેઈન કરવું
- ઓડિટ ઓબ્જેક્શનનો નિકાલ કરાવવાની કામગીરી સંભાળવી.
- ઓફિસ ખરીદી અંગેના ડેડ સ્ટોક રજીસ્ટરની જાળવણી કરવી.

### **લેબોરેટરી ટેકનીશીયન :-**

- ઝોનમાંથી આવેલ મેલેરિયા/ફાઈલેરિયા સ્લાઈડોનું સ્ટેનીંગ કરી પરિક્ષણ કરવું તથા સમયસર પરિણામ આપવું.
- શંકાસ્પદ ડેન્ચુ/ચિકુનગુનિયા કેસોના સેમ્પલ લઈ પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવા.
- મેલેરિયા/ફાઈલેરિયાની સ્લાઈડોનું પરિક્ષણ તથા તેને સંલગ્ન એન્ટોમોલોજીકલ વર્ક કરવું.
- સમગ્ર શહેરમાંથી એકત્રીત કરેલ સ્લાઈડોનો ડેવાઈઝ, વીકવાઈઝ, મન્થવાઈઝ, કોડવાઈઝ, ઈયરવાઈઝ, યુનિટવાઈઝ, ઝોનવાઈઝ ડેટા મેઈન્ટેઈન કરવા તથા ઉપરી અધિકારી માંગે ત્યારે જે-તે મુજબની સચોટ માહિતી પુરી પાડવી.
- મેલેરિયા માટે પોઝીટીવ જાહેર થયેલ દર્દીને "મેલેરિયા પત્રક" જરૂરી વિગત ભરીને અચુક આપવું. જેથી ફરીવાર દર્દી સારવાર માટે શહેરી આરોગ્ય કેન્દ્ર/લેબોરેટરી ટેકનીશીયન પાસે આવે ત્યારે આ કાર્ડ સાથે લાવે તેવો આગ્રહ રાખવા માટે જણાવવું.
- ઈનસેક્ટ કલેક્ટર દ્વારા કલેક્ટ થયેલ મચ્છરોનું આઈડેન્ટીફિકેશન તથા ફાઈલેરિયા માટે ડિસેક્ટ કરેલ મચ્છરોની સ્લાઈડોનું પરીક્ષણ કરી રોજે રોજની મેલેરિયા, ફાઈલેરિયા અને એડિસ વેક્ટર ડેન્સીટીની માહિતી તૈયાર કરવાની તથા મેલેરિયા અને એડિસ વેક્ટર મળેલ સ્થળની જાણ જંતુનાશક અધિકારી તથા જે તે ઝોનના આસી. જંતુનાશક અધિકારીને કરવાની રહેશે. ઉપરોક્ત તમામ માહિતી ડેવાઈઝ, મન્થવાઈઝ, ઈયરવાઈઝ, યુનિટવાઈઝ તેમ જ ઝોનવાઈઝ તૈયાર કરવાની રહેશે.
- ઉપરી અધિકારી તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

### **ક્લાર્ક :-**

- કલેરીકલને લગતી તમામ કામગીરી કરવી.
- દરેક ઝોનમાંથી જંતુનાશક દવાની ડિમાન્ડ મંગાવી રજૂ કરવી, ટેન્ડર બનાવવા.
- જંતુનાશક દવાના બીલ બનાવી પેમેન્ટની કાર્યવાહી કરવી.
- એગ્રીમેન્ટ તૈયાર કરાવવા.
- કોમ્પ્યુટર પર પ્રોગ્રામ એન્ટ્રી કરી જુદા જુદા પત્રકો તૈયાર કરવા.

- કોમ્પ્યુટર પર ખાતાને લગતી તમામ કામગીરી/રેકર્ડ્સ તૈયાર કરવા.
- ઉપરી અધિકારી તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

### **સ્ટોર કીપર :-**

- જંતુનાશક દવાનો બીલ મુજબનો સ્ટોક મેળવી તેની ચકાસણી કરી, જુદા જુદા ઝોનોમાં જરૂરીયાત મુજબ વિતરણ કરવું.
- જંતુનાશક દવાના સેમ્પલો ટેસ્ટીંગ માટે મોકલવા.
- કોમ્પ્યુટર પર સ્ટોર રિસીવડ વાઉચર (SRV) અને સ્ટોર ઈસ્યુ વાઉચર (SIV) તૈયાર કરવા.
- ઉપરી અધિકારી તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

### **સેનેટરી ઈન્સપેક્ટર (વી.બી.ડી.સી) :-**

- (૧) તે વાહક જન્ય રોગ નિયંત્રણ અંગેની તમામ કામગીરી બાબતનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. એન્ટીલાવલની કામગીરી, પાયરેથ્રમ દ્વારા થતી ધુમ્રસેરની કામગીરી અને મચ્છર ઉત્પત્તિ સ્થાનો ઘટાડવા અંગેના વિવિધ પગલાઓ જેવા કે, બાયો-એન્વાયરનમેન્ટલ નિયંત્રણના પગલાઓ બાબતે સુમાહિતગાર હોવો જોઈએ. પોરાભક્ષક માછલીઓ દ્વારા પોરાનાશક કામગીરીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. રાસાયણિક પોરાનાશક દવાઓના ઉપયોગ બાબતે જાણકાર હોવો જોઈએ.
- (૨) તેના તાબા હેઠળના કર્મચારીઓની રોજે રોજની કામગીરી બાબતે તે પોતે સંપૂર્ણ જવાબદાર રહેશે. જંતુનાશક દવા વપરાશ તેમજ પોરાનાશક તેલના વપરાશની રોજે રોજની નોંધ તેણે સ્ટોક રજીસ્ટરમાં કરાવવાની રહેશે.
- (૩) તેણે ટોચ, ડીપ, દોરી, વર્ક ડાયરી હંમેશા પોતાની સાથે રાખવાના રહેશે, અને તેના દ્વારા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી તેને નિયત ડોઝમાં યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરાવવાનો રહેશે.
- (૪) કર્મચારીઓ દ્વારા યોગ્ય સ્થાને યોગ્ય માત્રામાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવે, દવાનો દુરુપયોગ ન થાય, તેમજ જરૂરીયાત મુજબ દવાનો આગોતરો જથ્થો સંગ્રહ કરવા અંગેની જવાબદારી તેમની રહેશે.
- (૫) તેણે વિસ્તારમાં ટ્રીટમેન્ટ આપ્યા વિનાના મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢી તાત્કાલિક તે અંગેની જાણ આસી. જંતુનાશક અધિકારીશ્રી અને જંતુનાશક અધિકારીશ્રીને કરવી.
- (૬) તેણે મચ્છર નિયંત્રણ પ્રોગ્રામનું સઘન અને નિષ્ઠાપુર્વકનું કોસ ચેકીંગ હાથ ધરવાનું રહેશે.
- (૭) તેના તાબા હેઠળના કર્મચારીઓ ફરજના પુરેપુરા સમય દરમિયાન ફિલ્ડમાં કાર્યરત રહે તે અંગેની તકેદારી રાખવી. તેના વિસ્તારમાં ટ્રીટમેન્ટ આપ્યા વિનાના મળેલ ઓરિડીંગ માટે તેઓ પોતે જવાબદાર ગણાશે. તેણે જાતે લાવલ ડેન્સિટી/એડલ્ટ ડેન્સિટીનું વ્યક્તિગત કોસ ચેકીંગ કરવાનું રહેશે.
- (૮) તેણે એકટીવ-પેસીવ સર્વેલન્સ, ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વે, પેરી ડોમેસ્ટીક સર્વેની તમામ કામગીરીનું સુપરવિઝન કરવાનું રહેશે.
- (૯) એમના યુનિટમાં ફાળવવામાં આવેલ જંતુનાશક દવાઓ, સાધન-સામગ્રીનો દુરુપયોગ કે ઉચાપત ન થાય તેની તકેદારી લેવી. અન્યથા તેની તમામ જવાબદારી એમના શીરે રહેશે.
- (૧૦) તેણે સાધન-સામગ્રીના યોગ્ય નિભાવની તકેદારી રાખવી અને ગુમ થયેલ સાધન-સામગ્રી બાબતે જવાબદારી નક્કી કરી ઉપરી અધિકારીને ધ્યાને વિગત લાવવાની રહેશે.
- (૧૧) તેણે તમામ પ્રકારના મચ્છરોની ઓળખ કરતા આવડવું જોઈએ. વિશેષ કરીને એનો ફીલીસ સ્ટેફન્સી અને એનોફીલીસ ક્યુલીસીફેસીસથી માહિતગાર હોવા જોઈએ.
- (૧૨) તેણે સ્ટોક રજીસ્ટર, લોગબુક, દૈનિક રીપોર્ટ વગેરેનું રીપોર્ટીંગ કરી રિપોર્ટ આસી. જંતુનાશક અધિકારી/જંતુનાશક અધિકારીશ્રીને સમયમર્યાદામાં નિયમિત પહોંચાડવાનો રહેશે.
- (૧૩) તેણે તેનો ફિલ્ડ ચેકીંગનો પ્રોગ્રામ એવી રીતે બનાવવો કે જેથી ફિલ્ડના તમામ ઉત્પત્તિ સ્થાનો મહિનામાં ઓછામાં ઓછા એક વાર ચેક કરી શકાય.

- (૧૪) મચ્છર વધુ હોય તેવા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિનો ક્યાસ તેણે સમયાંતરે નિયમિત રીતે હાથ ધરવો. તેના વિસ્તારના નવા ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢી આસી.જંતુનાશક અધિકારીશ્રી /જંતુનાશક અધિકારીશ્રીના ધ્યાન ઉપર લાવી રેકર્ડમાં નોંધ કરી જરૂરી પગલાં લેવા.
- (૧૫) તાબા હેઠળના કર્મચારીઓના વિસ્તારમાં સવારે અને સાંજે એમ બન્ને સમયે કર્મચારીઓની હાજરી લેવી.
- (૧૬) નોટીસ ઈસ્યુ કરવા છતાં સમય મર્યાદામાં ખામી દૂર ન કરનાર ઈસમો પાસેથી વહીવટી ખર્ચ વસુલાતની અથવા કોર્ટ કેસની કામગીરી કરવાની રહેશે.
- (૧૭) યુનિટની તમામ કામગીરીનું સંપૂર્ણ સુપરવીઝન તેમણે કરવાનું રહેશે.
- (૧૮) તેણે તેમના ઉપરી અધિકારીઓ દ્વારા જે સુચનો મળે તે મુજબની કામગીરી કરવાની રહેશે.

### **સેનેટરી સબ ઈન્સપેક્ટર (વી.બી.ડી.સી) :-**

- (૧) તેઓને ફાળવવામાં આવેલ એન્ટીલાવલ વર્કની રોજેરોજની કામગીરી, સર્વેલન્સ અને ઈન્ટ્રાડોમેસ્ટીક વર્કની કામગીરી અને સ્ટાફનું સુપરવીઝન કરવાનું રહેશે.
- (૨) તેઓએ તેમના વોર્ડ-વિસ્તારમાં રોજે રોજ ઉપયોગમાં લેવામાં આવતી જંતુનાશક દવાના વપરાશની માહિતી રાખવાની રહેશે. જે માહિતીની નોંધ ફાઈલેરીયા મેલેરીયા ઈન્સપેક્ટરને લખાવવી.
- (૩) તેણે ટોચ, ડીપ, દોરી, વર્ક ડાયરી હંમેશા પોતાની સાથે રાખવાના રહેશે, અને તેના દ્વારા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી તેમાં નિયત ડોઝમાં યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરાવવાનો રહેશે.
- (૪) તેણે તેના તાબા હેઠળના પ્રાઈમરી હેલ્થ વર્કર તેમજ બેલદારને ફરજના પુરેપુરા સમય સુધી ફિલ્ડમાં હાજર રહી તમામ બ્રિડીંગ સ્થાનો પર માઈનોર એન્જી. વર્ક કરી દવાનો છંટકાવ કરે તેની તકેદારી રાખવાની રહેશે. જો કોઈ પણ ઉત્પત્તિ સ્થાન ટ્રીટમેન્ટ આપ્યા વગરનો જણાશે તો તે માટે તેની જવાબદારી ગણવામાં આવશે.
- (૫) સાધન-સામગ્રી સારી (ચાલુ) હાલતમાં રહે, અને રોજે રોજ તેની કાળજી લેવાય તે મુજબ વ્યવસ્થા કરવી.
- (૬) તેણે તેના તાબા હેઠળના કર્મચારીઓના ઉપ-વિસ્તારો અને બ્રિડીંગ સ્થાનો દર્શાવતો નકશો રાખવાનો રહેશે અને તેની નકલ તાબા હેઠળના પ્રાથમિક હેલ્થ વર્કરને આપવી, અને જરૂરી માર્ગદર્શન પુરું પાડવું.
- (૭) કચરા રહીત અને લીલ રહીત ગટરો રહે તે જોવું કે જેથી છાંટવામાં આવેલ જંતુનાક દવાનું પરિણામ મળે તેની તકેદારી રખાવવી.
- (૮) તેના સમગ્ર કાર્યક્ષેત્ર વિસ્તારને ૬ પેટા વિભાગોમાં વહેંચી તેની જે તે દિવસની સીમા રેખા દર્શાવતો નકશો તૈયાર કરવો.
- (૯) તેના તાબા હેઠળના કર્મચારીઓની શિસ્ત અંગેની જવાબદારી તેના શીરે રહેશે, ફિલ્ડમાં કર્મચારીઓની સવારની અને સાંજની હાજરી તેણે રૂબરૂમાં લેવી.
- (૧૦) તાબા હેઠળના કર્મચારીઓને સવારે સાધન-સામગ્રી આપવી અને સાંજે બરાબર સફાઈ કરાવડાવી પરત મેળવવી.
- (૧૧) તમારા યુનિટમાં ફાળવવામાં આવેલ જંતુનાશક દવાઓ, સાધન-સામગ્રીનો દુરુપયોગ કે ઉચાપત ન થાય તેની તકેદારી લેવી. અન્યથા તેની તમામ જવાબદારી તમારા શીરે રહેશે.
- (૧૨) ગુમ થયેલ સાધન-સામગ્રી અંગે સંબંધિત કર્મચારીની જવાબદારી નક્કી કરી તાકીદે તેનો રીપોર્ટ ફાઈલેરીયા-મેલેરીયા ઈન્સપેક્ટરને તાત્કાલિક રીકવરી માટેની કાર્યવાહી માટે કરવો. તેમજ આવા ગુમ થયેલ સાધન-સામગ્રીના ગુમ થવા અંગેના કારણો શોધી વિગતવાર વાસ્તવિક કારણો સહીતનો લેખિત રીપોર્ટ ઉપરી અધિકારીને કરવો.
- (૧૩) અર્બન હેલ્થ સેન્ટરનો પોઝીટીવ કેસોની માહિતી મેળવી કરવા જોગ કામગીરી જેવી કે, એન્ટીમેલેરીયલકામગીરી, ધુમ્રસેર, માસ અને કોન્ટેક્ટ સ્મીયર, ફોલોઅપ સ્મીયર, ફોલોઅપ ટ્રીટમેન્ટ કામગીરી કરવી.
- (૧૪) માસ ટ્રીટમેન્ટની કામગીરી અને તેનો રેકર્ડ તેના ઉપરી અધિકારીને મોકલવાની જવાબદારી તેમની રહેશે.
- (૧૫) તેના કાર્યક્ષેત્ર વિસ્તારમાં રેડીકલ ટ્રીટમેન્ટ રૂબરૂ આપવાની જવાબદારી તેના શીરે રહેશે.



- (૧૬) નોટીસ ઈસ્યુ કરવા છતાં સમય મર્યાદામાં ખામી દૂર ન કરનાર ઈસમો પાસેથી વહીવટી ખર્ચ વસુલાત કરવાનો રહેશે. તથા કોર્ટ કેસની કામગીરી આપવામાં આવેલ ટાર્ગેટ મુજબ તેણે કરવાની રહેશે.
- (૧૭) તેણે તેમના ઉપરી અધિકારીઓ દ્વારા જે સુચનો મળે તે મુજબની કામગીરી કરવાની રહેશે.
- (૧૮) તેણે પોતાના વિસ્તાર માટે મેળવેલ જંતુનાશક દવા અને મેલેરિયા વિરોધી ઔષધોનો જથ્થો મેળવ્યાની નોંધણી સ્ટોક રજીસ્ટરમાં કરવાની રહેશે.

### **પ્રાયમરી હેલ્થ વર્કર (ઈન્સેક્ટ કલેક્ટર) ની ફરજો:-**

આઈ.સી. મચ્છર નિયંત્રણ ઓપરેશનના કોસ ચેકીંગ કાર્યનો એક ભાગ છે. તે નિયંત્રણ કાર્યના નિરીક્ષણ અને કાર્યમાં અને કામગીરીમાં સુધારામાટે ચાવીરૂપ ભૂમિકા નિભાવી શકે છે. તેણે કલેક્શન માટેની જરૂરી સાધન સામગ્રી રાખવાની રહેશે. તેણે એન્ટોમોલોજીકલ ડેટા ખૂબ જ ઈમાનદારીપૂર્વક આપવાના હોય છે. તેના દ્વારા પુરેપુરી ઈમાનદારીથી નહીં આપવામાં આવેલ ડેટા નિયંત્રણ પ્રોગ્રામની કામગીરીને ગેર માર્ગે દોરનારા અને અર્થ-હીન સાબિત થાય છે. તેણે પોતાની જાતને મચ્છર પકડવાની પધ્ધતિ સાથે સુસંગત કરવાની રહે છે. તે ઈચ્છનીય છે કે તે આ કામગીરી માટે કેળવાયેલ હોય અને તે જાણતો હોવો જોઈએ કે તેણે શું કરવાનું છે ? અને કેવી રીતે કરવાનું છે ? તેણે તેની કામગીરીની જરૂરિયાત માટેની સાધન સામગ્રી ફરજના સમય દરમ્યાન અચૂક પણે સાથે રાખવાની રહેશે. જે નીચે મુજબ છે.

(૧) કેનવાસની બેગ

(૨) એક મોસ્કીટો સકશન ટયુબ

(૩) ટેસ્ટ ટયુબસ

(૪) કોટન

- (૧) જે તે દિવસે તેને ફાળવેલ કલેક્શન સેન્ટરો પૈકી તેણે દરેક સેન્ટરો પર ૧૫ મીનીટ ફીક્સ કલેક્શન સેન્ટર ઉપરાંત ૧૫ મીનીટ રેન્ડમ કલેક્શન સેન્ટર ઉપર કામગીરી કરવી.
- (૨) પ્રતિદિન તેણે પાંચ ફિક્સ (રૂટિન) અને પાંચ રેન્ડમ કલેક્શન સેન્ટરોની મુલાકાત લેવાની રહેશે. આમ અઠવાડીયા દરમ્યાન તેણે ૨૫ ફિક્સ તેમજ ૨૫ રેન્ડમ મચ્છર પકડવાના સ્થળોની મુલાકાત લેવાની રહે છે. તેણે તેના આગમનની સુચના ઘરના કબજેદારને આપવી અને તે સેન્ટર પર કલેક્શનના સમય દરમ્યાન કોઈ પુરૂષ ફેમીલી મેમ્બર ઘરના અંદરનાં રોકાણ દરમ્યાન તેની સાથે રહે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે.
- (૩) દરેક સેન્ટર પર કામગીરી ચાલુ કરતા પહેલા પોતાના કામગીરી રજીસ્ટરમાં સમયની નોંધ કરવી. ત્યાર બાદ તરત જ કામગીરી શરૂ કરવી. કલેક્શન સેન્ટરમાં ઘરના એક નાકેથી તેણે મચ્છરની શોધ કરવી અને મચ્છરના આરામ કરવાના સ્થળો જેવા કે, અંધારા ખૂણા, ફર્નીચરના નીચેના સ્થાનો, દિવાલો પરના સાધનોની પાછળના સ્થળો ઉપરથી ટયુબમાં મચ્છરો પકડયા બાદ તેમને ટેસ્ટ ટયુબમાં ટ્રાન્સફર કરવા, અને ટેસ્ટ ટયુબના મુખને રૂથી બંધ કરવું. રૂને એટલા નીચેથી બંધ કરવું કે, આ રીતે ૪ કલેક્શન એક જ ટેસ્ટ ટયુબમાં રાખી શકાય.
- (૪) ટેસ્ટ ટયુબના મુખને રૂ દ્વારા એવી રીતે બંધ કરવું કે જેથી મચ્છરો બહાર ઉડી શકે નહિ. આ મુજબના મચ્છરોને ટેસ્ટ ટયુબમાં મુકયા બાદ તેણે કલેક્શન સેન્ટરના સ્થળ, મચ્છરના પ્રકાર વગેરેની માહિતી અને વિસ્તારનું નામ નોંધવાનું રહેશે.
- (૫) I.C. એ અલગ અલગ કલેક્શન સેન્ટરો પરથી પકડાયેલ મચ્છરો માટે અલગ અલગ ટેસ્ટ ટયુબ વાપરવાની રહેશે. મચ્છર મુકેલ ટેસ્ટ ટયુબને ભીના રૂનાં કપડામાં કે ઠંડી જગ્યામાં રાખવી અને મચ્છરની ઓળખ જે તે દિવસે જ કરી તેની વિસ્તૃત નોંધ રાખવી. તેણે એન્ટોમોલોજીકલ પધ્ધતિથી પ્રતિ વ્યક્તિ

મચ્છરની ઘનતા (ડેન્સિટી), પોરાની ઘનતા (લાવલ ડેન્સિટી) અને સસેપ્ટીબીલીટી ટેસ્ટ તમેજ પુખ્ત મચ્છરોની ઓળખ વિગેરેની માહિતીની જાણકારી મેળવવાની રહેશે,

- (૬) તેમજ મચ્છરોની અને સાધનોની જાળવણી અને આંકડાકીય માહિતીની નોંધ અંગેની કામગીરી કરવાની રહેશે. તેણે ફિલ્ડ વિઝીટ દરમ્યાનએન્ટી લાવલની કામગીરીના સ્થળે સંલગ્ન વેક્ટર ડેન્સિટી અને લાવલ ડેન્સિટીની સરખામણી કરવાની રહેશે.
- (૭) જો કાયમી ફીક્ષ સેન્ટર બંધ મળે તો તેણે તેના બદલે તે જ વિસ્તારનો એક રેન્ડમ સેન્ટર ઉપર વધારે કલેક્શન કરવું, પરંતુ જો કોઈ સેન્ટર કાયમી ધોરણે બંધ મળે તો સક્ષમ સત્તાની મંજૂરી મેળવી નવું સેન્ટર શરૂ કરવું.
- (૮) I.C. એ મચ્છરોની ઓળખ કરી તેનો રીપોર્ટ ઈન્સેક્ટીસાઈડ ઓફિસરને કરવાનો રહેશે.
- (૯) I.C. એ વિવિધ એન્ટોમોલોજીક ટેકનીક જેવી કે, મોસ્કીટો આઈડેન્ટીફિકેશન, મોસ્કીટો ડીસેક્શન, પર મેન અવર ડેન્સિટી, લાવલ ડેન્સિટી, સસેપ્ટીબીલીટી ટેસ્ટ વગેરેથી માહિતગાર થવાનું રહેશે.
- (૧૦) I.C. એ ફિલ્ડની મુલાકાત દરમ્યાન તેણે જુદા જુદા વિસ્તારોમાં એડલ્ટ વેક્ટર ડેન્સિટી તેમજ લાવલ ડેન્સિટીને ધ્યાને લઈ એન્ટીલાવલ કામગીરી સવારે ૬-૦૦ વાગ્યાથી બપોરે ૧૨-૦૦ વાગ્યા સુધી કરવાની રહેશે.
- (૧૧) I.C. એ લેબોરેટરીમાં ફીમેલ મોસ્કીટો ડિસેક્શન અને ઈનફેક્ટીવીટી વગેરે શોધવાના અને નોંધવાનાં રહેશે. દર મહિનાને અંતે આખા માસ દરમ્યાન કરેલ ઈન્ટ્રાડોમેસ્ટીક કામગીરી બ્રિડીંગ રીપોર્ટ દ્વારા દર્શાવવાની રહેશે. જે દર મહિનાની પાંચ તારીખમાં જે તે મુખ્ય કચેરીની ફાઈલેરીયા લેબ.માં પહોંચાડવાની રહેશે.
- (૧૨) I.C. એ ટોચ, ડીપ, દોરી, રજીસ્ટર હંમેશા પોતાની સાથે રાખવાના રહેશે, અને તેના દ્વારા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી મળેલ બ્રિડીંગનો નાશ કરાવવાનો રહેશે.
- (૧૩) I.C. એ તેના સેન્ટરો પરથી મળેલ વેક્ટરની જાણ જે તે યુનિટનાં એસ.આઈ., એસ.એસ.આઈ. અથવા હાજર રહેલ જવાબદાર કર્મચારીને જે તે દિવસે કરવાની રહેશે. આ ઉપરાંત તેમના ઉપરી અધિકારી દ્વારા જે સુચના મળે તે મુજબની કામગીરી કરવાની રહેશે.

### **પ્રાયમરી હેલ્થ વર્કર (મેલેરીયા સર્વેલન્સ અને ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વે.)ની ફરજો :-**

મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ વધુ ઘનિષ્ઠ અને પરિણામલક્ષી બનાવવા અંદાજીત દસ હજારથી અગિયાર હજારની વસ્તી/સોંપવામાં આવેલ વિસ્તારને આવરી લેતાં અંદાજીત બે અજાર ઘરો/સોંપવામાં આવેલ ઘરો પૈકી દરરોજ ૧૫૦ થી ૧૭૫ ઘરોમાં વાહકજન્ય રોગોને નિયંત્રણ હેઠળ રાખવા માટે સમગ્ર વિસ્તારનો પખવાડીક સર્વે કરવાનો રહેશે. જેમાં એકટીવ સર્વેલન્સ, ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વે, નોટીસ આપવી, કેસોનું ફોલોઅપ, ડ્રગ કોમ્પ્લાયન્સ જેવી તમામ કામગીરી કરવાની રહેશે. ઉપરાંત વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળની અન્ય કામગીરી કરવાની રહેશે.

- (૧) પ્રાયમરી હેલ્થ વર્કરે તેને સોંપાયેલ વિસ્તારની વસ્તીનું રજીસ્ટર તેની યુનિટ ઓફિસે રાખવાનું રહેશે.
- (૨) પ્રાયમરી હેલ્થ વર્કરે તેના વિસ્તારમાં આવેલ ઘરોની દર પંદર દિવસે મુલાકાત લઈ ફીવર સર્વે/ઈન્ટ્રાડોમેસ્ટીક બ્રિડીંગ સર્વે કરવો.

- (૩) પ્રાયમરી હેલ્થ વર્કરે ટોચ, ડીપ, દોરી, રજીસ્ટર હંમેશા પોતાની સાથે ખાતા દ્વારા આપેલ હેન્ડબેગમાં રાખવાના રહેશે, અને તેના દ્વારા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી મળેલ બ્રિડીંગનો ટેમ્પ્લેટ દ્વારા નાશ કરાવવાનો રહેશે.
- (૪) પ્રાયમરી હેલ્થ વર્કરે તેની ઘર-ઘરની મુલાકાત વેળા દરેક તાવના કેસનાં દર્દીની લોહીની સ્લાઈડ લઈ તેનું થીક અને થીન સ્મીયર તૈયાર કરી અને તેની નોંધ MF.2 રજીસ્ટરમાં કરવી. તેમજ જે તે સ્લાઈડ પર વ્યવસ્થિત કોડ નંબર અને સ્મીયર નંબર અંકિત કરવા.
- (૫) પ્રાયમરી હેલ્થ વર્કરે કાર્યક્ષેત્ર હેઠળનાં વિસ્તારમાં આવતા બાંધકામોનો નિયમિત સર્વે કરવો. તેમજ તેમાં રહેલ મજૂરોની સ્લાઈડ લેવી અને તાવના દર્દીઓને FRT આપવી.
- (૬) પ્રાયમરી હેલ્થ વર્કરે રોજે રોજ વર્કડાયરી, HI, BI, CI અને MBER, MPI વીકલી તથા મંથલી મેઈન્ટેઈન કરવાના રહેશે તથા વર્ષનાં અંતે ABER, API વિગેરે મેઈન્ટેઈન કરવાનો રહેશે. Follow up, Contact Smear નું મોનીટરીંગ કરવાનું રહેશે.
- (૭) તેણે દરેક ઘરે મેલેરીયા અંગે નીચે મુજબના પાંચ પ્રશ્નો અચૂક પૂછવા.
- (i) ઘરમાં કોઈને તાવ છે ?
  - (ii) એક વર્ષથી નાના કોઈ બાળકને તાવ છે ?
  - (iii) છેલ્લા પંદર દિવસમાં કોઈને તાવ હતો ?
  - (iv) ઘરની કોઈ વ્યક્તિએ છેલ્લા પંદર દિવસમાં બહારગામની મુલાકાત લીધેલ ? તેને તાવ આવેલ ?
  - (v) ઘરમાં કોઈ મહેમાન આવેલ છે ? તેને તાવ આવે છે ?
- ઉપરનાં કોઈ પણ પ્રશ્નનો જવાબ "હા" માં જણાય તો તેવી વ્યક્તિની સ્લાઈડ લેવી તેમજ FRT આપવી.
- (૮) પ્રાયમરી હેલ્થ વર્કરે મેળવેલ તમામ લોહીની સ્લાઈડોના સંદર્ભે દર્દીને મેલેરીયા નિયંત્રણ માટેની દવા NVBDCP એ સુચવેલ માત્રામાં રૂબરૂમાં જ ગળાવવાની રહેશે.
- (૯) દરેક તાવના કેસને તેણે ફીવર રેડીકલ ટ્રીટમેન્ટ આપ્યા બાદ જરૂર જણાય તો વધુ સારવાર માટે નજીકનાં અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરવા જણાવવું.
- (૧૦) પ્રાયમરી હેલ્થ વર્કરે પોતે મેળવેલ લોહીના નમુનાઓ અને વિતરણ કરેલ દવાની માહિતીની MF.2 માં નોંધ કરવી.
- (૧૧) પ્રાયમરી હેલ્થ વર્કરે ડીસ્પોઝેબલ લાન્સેટ અને સ્વચ્છ માર્ફકો સ્લાઈડનો જ ઉપયોગ કરવાનો રહેશે, તથા સ્મીયર (થીક અને થીન) વ્યવસ્થિત રીતે બનાવવું.
- (૧૨) પ્રાયમરી હેલ્થ વર્કરે દરેક ઘર ઉપર 'મુલાકાત-કાર્ડ' અવશ્ય લગાવવો અને દરેક પખવાડીક મુલાકાત વખતે સહી કરી તારીખની નોંધ કરવી. બીજી મુલાકાત દરમ્યાન કાર્ડ જોવા ન મળે તો તેવા ઘરો પર નવો કાર્ડ લગાવવાનો રહેશે.
- (૧૩) પ્રાયમરી હેલ્થ વર્કરે ઘરના તમામ પાણી સંગ્રહસ્થાનો/વાસણો ચેક કરવા, તેમજ મચ્છરની ઉત્પત્તિ જણાય તો તેનો નાશ કરવો તેમજ તે ઘરનાં રહીશને નોટિસ પહોંચાડવી.
- (૧૪) પ્રાયમરી હેલ્થ વર્કરે ઘરની પાણી સંગ્રહ કરવા માટેની ઓવરહેડ/અન્ડરગ્રાઉન્ડ/ગ્રાઉન્ડ ટાંકીઓ પર હવાચુસ્ત ઢાંકણ ચેક કરવું. તેમ ન હોય તો હવાચુસ્ત ઢાંકણ બનાવવા માટે નોટીસ આપવી.
- (૧૫) પ્રાયમરી હેલ્થ વર્કરે ઘરની ઓવરહેડ ટાંકીઓના ઢાંકણ સુધી પહોંચવા માટે પડતી અગવડતાના સંદર્ભમાં ઘરના કબજેદારને 'સીડી'(દાદર)ની વ્યવસ્થા કરવા અંગેની નોટિસ પહોંચાડવી.
- (૧૬) પ્રાયમરી હેલ્થ વર્કરે દ્વારા આપવામાં આવેલ તમામ 'નોટીસ'નું તેણે બીજી મુલાકાત વખતે ફોલો અપ કરવું, અને જો ખામી દૂર ન થયેલ હોય તો આગળની કાર્યવાહી માટે યુનિટનાં કર્મચારીને જાણ કરવી.
- (૧૭) પ્રાયમરી હેલ્થ વર્કરે તેમના ઉપરી અધિકારીઓ દ્વારા જે સુચનો મળે તે મુજબની કામગીરી કરવાની રહેશે.
- (૧૮) પ્રાયમરી હેલ્થ વર્કરે પીવાના પાણી સિવાય તમામ પાણી ભરેલા ખુલ્લા કન્ટેનરોમાં તેમજ બ્રિડીંગ જણાયેલ કન્ટેઈનરોમાં નિયત ડોઝ મુજબ ટેમ્પ્લેટની ટ્રીટમેન્ટ આપવાની રહેશે.

- (૧૯) જે તે મિલકતનાં ધાબા/છાપરા/વરંડા પર પડી રહેલ નકામો કાટમાળ/સાધનો/ટાયરો કે જેમાં વરસાદી પાણીના ભરાવાની શક્યતાઓ છે, તેનો સુરક્ષિત સ્થળે નિકાલ કરાવવો.
- (૨૦) ફાઈલેરીયા નાઈટ સર્વેની કામગીરી રજા સિવાયના દિવસોમાં રોજે રોજ બપોરે ૨-૦૦ થી રાત્રે ૧૦-૦૦ દરમ્યાન કરવાની રહેશે. આ ઉપરાંત ટી.પી.એમ. મુજબના વિસ્તારમાં બપોરે ૨-૦૦ થી ૮-૦૦ દરમ્યાન ઘરે ઘરે ફરી, સર્વે દરમ્યાન ફાઈલેરીયા રોગ અંગે જનજાગૃતિ કેળવી, હાઈડ્રોસીલ/લિફ્ટેડીમાના કેસો શોધી મળેલ કેસને મોર્બીડીટી મેનેજમેન્ટ અંગેની સમજણ હાપવાની રહેશે. રાત્રે ૮-૩૦ થી ૧૦-૦૦ દરમ્યાન અગાઉથી નકકી કરેલ અમુક અમુક ઘરોમાંથી માઈક્રો ફાઈલેરીયા માટે ૭૫ જેટલા લોહીના નમુના એકત્રિત કરવાના રહેશે.
- (૨૧) જાન્યુઆરીથી જુન માસ દરમ્યાન MBER(Monthly Blood Examination Rate) ચ ૦.૮ % , જ્યારે જુલાઈથી ડિસેમ્બર માસ દરમ્યાન ૧.૨ થી ૧.૮ જેટલો હોવો જોઈએ.

**નોંધ :-** સગભા સ્ત્રીઓને તેમજ એક વર્ષથી નાના બાળકોને પ્રિમાકવીન આપવી નહિ.

### **પ્રાયમરી હેલ્થ વર્કર (એન્ટીલાર્વલ કામગીરી) ની ફરજો :-**

- (૧) પ્રાયમરી હેલ્થ વર્કર તેઓની રોજે રોજની કામગીરીની નોંધ રજીસ્ટરમાં રાખવી.
- (૨) દર અઠવાડિયે (સોમવારથી શનિવાર સુધીમાં ) એક ટીમે ૨.૫૬ સ્કવેર કિ.મી. વિસ્તારમાં એન્ટીલાર્વલ કામગીરી કરવાની રહેશે. સદર ટીમમાં વિસ્તાર અને વસ્તીના આધારે ૫ થી ૭ ફિલ્ડવર્કરો/બેલદારો રાખી માઈનોર એન્જિનિયરીંગ વર્ક તથા નવા બંધાતા બાંધકામોમાં લાર્વીસાઈડ ટ્રીટમેન્ટ આપવાની રહેશે.
- (૩) દરેક પ્રાઈમરી હેલ્થ વર્કરે તેમને સોંપવામાં આવેલ બેલદારની કામગીરીનું સુપરવીઝન કરવાનું રહેશે. તેના કાર્યક્ષેત્રના વિસ્તારમાં એન્ટીલાર્વલની કામગીરી પરિણામલક્ષી રહે તેની તેણે તકેદારી રાખવાની રહેશે.
- (૪) PHW તેના ફિલ્ડમાં થતી કામગીરીથી પુરેપુરો માહિતગાર હોવો જોઈએ, તેમજ વખતો વખત ઉપરી અધિકારી દ્વારા સુચન કરવામાં આવે તે કાર્ય કરાવવું.
- (૫) સમગ્ર કામગીરી માટે તે પોતે અતિ મહત્વની કડી છે, અને એન્ટીલાર્વલની કામગીરીની સફળતાનો મોટો આધાર તેની કામગીરી અને ક્ષમતા ઉપર છે. તેણે તેના કાર્યક્ષેત્ર વિસ્તારના પરમેનન્ટ બ્રિડીંગ સ્પોટ અને ટેમ્પરરી બ્રિડીંગ સ્પોટની માહિતી દર્શાવી યુનિટના ફાઈલેરીયા ઈન્સપેક્ટરને આપવાની રહેશે.
- (૬) તેણે ટોચ, ડીપ, દોરી, રજીસ્ટર હંમેશા પોતાની સાથ રાખવાના રહેશે, અને તેના દ્વારા મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધી તેને નિયત ડોઝમાં યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ કરાવવાનો રહેશે.
- (૭) તેને સોંપવામાં આવેલ સાધન સામગ્રી માટે તે પોતે જવાબદાર રહેશે અને તેની તેણે સંપુર્ણ કાળજી લેવાની રહેશે.
- (૮) તેને સોંપવામાં આવેલ બેલદારનાં કામની વહેંચણી તેણે એવી રીતે કરવી જેથી કામગીરી સમયે તે દરેકની કામગીરી ઉપર નિયંત્રણ રાખી શકે, અને જે તે દિવસનો સંપુર્ણ વિસ્તાર કવર કરી શકાય.
- (૯) તાબા હેઠળ કામદારોની કામની વહેંચણી તેણે એવી રીતે કરવી કે જે તે કામદારની જવાબદારી નકકી કરી શકાય, કરેલ કામગીરીની નોંધ તેણે તેના કામગીરી રજીસ્ટરમાં અચુક કરવી, અને પોતાના ઉપરી અધિકારી સમક્ષ તે રજુ કરવી.
- (૧૦) દિવસની કામગીરીના અંતે તાબા હેઠળના કર્મચારી પાસેથી સાધન સામગ્રી પરત મેળવી ફાઈલેરીયા-મેલેરીયા નિરીક્ષક પ્રતિ જમા કરાવવી અને જો સાધનોમાં માઈનોર રીપેરીંગ જરૂરી હોય તો તે તાત્કાલિક કરાવી સાધનો ચાલુ હાલતમાં રાખવા.


- (૧૧) પ્રાયમરી હેલ્થ વર્કરે ક્રોસ ચેકીંગ દરમ્યાન યુનિટના સેનેટરી ઈન્સપેક્ટર/ફાઈલેરીયા ઈન્સપેક્ટરે જણાવેલ કામગીરી તાત્કાલિક પુર્ણ કરવી, તેમજ દિવસ દરમ્યાન કરવામાં આવેલ કામગીરીનો રિપોર્ટ રોજ રોજ તેમના ઉપરી સુપરવાઈઝરી સ્ટાફને આપવો.
- (૧૨) તેણે ખુલ્લા તમામ પ્લોટો કે જેમાં ઢિરીંગ થવાની સંભાવના હોય, તેવા પ્લોટના રહીશોને ખાતા તરફથી તૈયાર થયેલ નોટીસ પહોંચાડવાની રહેશે.
- (૧૩) તેણે એન્ટીલાવલની કામગીરી દરમ્યાન મળી આવેલ ઢિરીંગનાં ઘરના રહીશોને ખાતા તરફથી તૈયાર થયેલ નોટીસ પહોંચાડવાની રહેશે.
- (૧૪) તેણે ઘર તેમજ બાંધકામની ઓવરહેડ ટાંકીઓના ઢાંકણ સુધી પહોંચવા માટે પડતી અગવડતાના સંદર્ભમાં ઘરના કબ્જેદારને 'સીડી'(દાદર)ની વ્યવસ્થા કરવા અંગેની ખાતા તરફથી તૈયાર થયેલ નોટિસ પહોંચાડવી.
- (૧૫) તેના દ્વારા આપવામાં આવેલ તમામ 'નોટીસ'નું તેણે બીજી મુલાકાત વખતે કોમ્પલાય કરવો, અને જો ખામી દૂર ન થયેલ હોય તો આગળની કાર્યવાહી માટે કચેરીને જાણ કરવાની રહેશે.
- (૧૬) ઉપરી અધિકારી દ્વારા મળતી વખતો વખતની સુચનાનો અમલ કરવાનો રહેશે.

### **ભેલદારની ફરજો :-**

- એન્ટી લાવલ કામગીરી હેઠળ જંતુનાશક દવાનો સ્પ્રે કરવો તથા ફેર્ગીંગ કરવું.
- તેમને સોંપેલ વિસ્તારોમાં તમામ પાણીના ભરાવા કે જેનો નિકાલ થઈ શકે તેમ ન હોય ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો.
- નિકાલ થઈ શકે તેવા પાણીના ભરાવાને નીક પાડી પાણીનો નિકાલ કરવો. મોટા જળાશયોમાં પોરા ભક્ક માછલીઓ મૂકવી.
- ઉપરી અધિકારી તરફથી સોંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે.

કલમ -૪(૧) (ખ) (૩)

દેખરેખ અને જવાબદારીનાં માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યવાહી :-



| કેટેગરી | A   | B                              | C  | D                              | E  | રીમાર્ક્સ |
|---------|---|--------------------------------|--|--------------------------------|--|-----------|
| અ.નં    | કાયમી રાખવા   | ૩૦/૩૫ વર્ષે રાખવા જોગ          | ૧૦ વર્ષે રાખવા જોગ   | ૫ વર્ષે રાખવા જોગ              | ૨ વર્ષે અથવા ઓડીટ થયેલ (જે પહેલું હોય તે)            |           |
| ૧       | (૧૧) સરકારશ્રીના ઠરાવો જેવા કે મ્યુનિ. ઈલેકશનને લગતા ઓર્ડર ઠરાવ, રૂલ્સ રેગ્યુલેશન, સ્ટેન્ડીંગ ઓર્ડર                         | (૧૦) સર્વિસ બુક                | (૧) બીલની ચુકવણી કર્યા અંગેનું રજીસ્ટર                     | (૯) ટ્રાન્સફર એન્ટ્રી          | (૧૮) પટાવાળાની ટપાલબુક                               | -         |
| ૨       | (૧૨) અગત્યના કાયમી વહીવટી પરિપત્રો, સ્થાયી આદેશો  | (૧૧) શિક્ષા કર્યા અંગેના હુકમો | (૪) પગાર અંગેના બીલો તથા એકવીટન્સ રોલ                      | (૩૭) પેન્શન રજીસ્ટર            | (૧૯) મ્યુનિ. સર્વિસમાંથી આપેલ રાજીનામા અંગેના પેપર્સ | -         |
| ૩       | (૧૭) ડી.પી ઓર્ડર  | -                              | (૫) ગેરહાજરી બાબતનું પત્રક                                 | -                              | -  | -         |
| ૪       | -   | -                              | (૧૦) કર્મચારીઓના લેબર ડીસ્પયુટ, આઈ.ટી. કેસ સંદર્ભના પેપર્સ | (૪૦) સ્ટોર્સ લેઝર              | (૨૨) કાયમી કર્મચારીઓનું મસ્ટર અને સમયપત્રક           | -         |
| ૫       | -   | -                              | -  | (૪૧) વર્કઓર્ડર રજીસ્ટર અને બુક | -  | -         |
| ૬       | -   | -                              | -  | (૪૩) ઈન્ડેન્ટ્સ બુક            | (૪૬) પેન્શન મેળવતા કર્મચારીઓનું વાર્ષિક સ્ટેટમેન્ટ   | -         |
| ૭       | (૪૩) સુપ્રિમકોર્ટ, હાઈકોર્ટ દ્વારા થયેલ છેવટનાં આદેશો અંગેની ફાઈલો, મ્યુનિ. ઈલેકશનને લાગત કેસો હોય તો તેના પણ છેવટના આદેશો. | -                              | -  | (૪૬) ૩૬ સ્ટોક રજીસ્ટર          | -  | -         |
| ૮       | (૮૯) બી.સી.ડી. કેટેગરીના નાશ કરવા જોગ કાગળોની મંજૂરી તથા તેનું લિસ્ટ  | -                              | -  | -                              | -  | -         |

**કલમ -૪(૧)(ખ)(૪)**

**પોતાના કાર્યો બજાવવા માટે પોતે નકકી કરેલા ધોરણો :-**

નેશનલ ગાર્ડ લાઈન મુજબ વાહક જનિત રોગ નિયંત્રણ/અટકાયતની કામગીરી, ફાઈલેરીયા-મેલેરીયા જેવા રોગ નિયંત્રણ / અટકાયવવા માટે લોકજાગૃતિ લાવવા અભિયાન ચલાવવાની કામગીરી.

**કલમ -૪(૧)(ખ)(૫)**

**પોતાના કાર્ય બજાવવા માટે પોતાની પાસેનાં અથવા પોતાના નિયંત્રણ હેઠળનાં અથવા પોતાના કર્મચારીઓ ધ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને રેકર્ડ :-**

કાર્ય બજાવવા માટે અથવા નિયંત્રણ હેઠળના અથવા કર્મચારીઓ ધ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને રેકર્ડ વિગેરે સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે

**કલમ -૪(૧)(ખ)(૬)**

**પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય એવા દસ્તાવેજોનું વર્ગીકરણ પત્રક :-**

નિયંત્રણ હેઠળ હોય એવા દસ્તાવેજોનું વર્ગીકરણ સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે.



| કેટેગરી | A           | B                             | C                     | D  | E   | રીમાર્ક્સ |
|---------|-------------|-------------------------------|-----------------------|--|---|-----------|
| અ. નં.  | કાયમી રાખવા | ૩૦/૩૫<br>વર્ષ<br>રાખવા<br>જોગ | ૧૦ વર્ષે રાખવા<br>જોગ | ૫ વર્ષે રાખવા જોગ  | ૨ વર્ષે અથવા ઓડીટ<br>થયેલ (જે પહેલું હોય<br>તે) |           |
| ૯.      | —           | —                             | —                     | (૫૩)મસ્ટર રોલ (૨૦૨૦-૨૦૨૪)  | —   | —         |
| ૧૦.     | —           | —                             | —                     | (૫૮)સ્ટોક રજીસ્ટર (૨૦૨૦-૨૦૨૪)  | —   | —         |
| ૧૧.     | —           | —                             | —                     | (૬૨)ઈનવર્ડ આઉટવર્ડ રજીસ્ટર (૨૦૨૦-૨૦૨૪)   | —   | —         |
| ૧૨.     | —           | —                             | —                     | —  | —   | —         |
| ૧૩.     | —           | —                             | —                     | (૬૪)પેન્શન ગ્રેજ્યુઈટીની સંમતિ આપતા પેપર્સ   | —   | —         |
| ૧૪.     | —           | —                             | —                     | (૬૫)હંગામી અને કામચલાઉ કર્મચારીઓના પેપર્સ  | —   | —         |
| ૧૫.     | —           | —                             | —                     | —  | —   | —         |
| ૧૬.     | —           | —                             | —                     | —  | —   | —         |
| ૧૭.     | —           | —                             | —                     | (૬૯)હાલનાં પગારધોરણ અને સીનીયોરીટી મુજબ તૈયાર કરેલ<br>કર્મચારીઓનું લીસ્ટ                           | —   | —         |
| ૧૮.     | —           | —                             | —                     | (૭૦)કર્મચારીઓ પાસેની વસુલાત : પુરેપુરી થયેલ વસુલાત અંગેની<br>સેવાપોથીમાં નોંધ કરવા બાબત.           | —   | —         |
| ૧૯.     | —           | —                             | —                     | (૭૧)વિશિષ્ટ કામગીરી બદલ આપવામાં આવેલ પ્રશંસાપત્ર કે ભેટ<br>બાબતેની નોંધ સેવાપોથીમાં નોંધ કરવા બાબત | —   | —         |
| ૨૦.     | —           | —                             | —                     | (૭૮)ઠરાવ રજીસ્ટર   | —   | —         |
| ૨૧.     | —           | —                             | —                     | (૫૨)ચુરણ પત્રવ્યવહારની વિગત રાખવાનું રજીસ્ટર)  | —   | —         |
| ૨૨.     | —           | —                             | —                     | (૮૧)મ્યુનિ. એક્ટ,નિયમ, વિનિયમમાં થયેલ ગુનો બાબતેની<br>ફરીયાદને લાગત પત્રવ્યવહાર                    | —   | —         |
| ૨૩.     | —           | —                             | —                     | (૮૨) ફરિયાદ રજીસ્ટર  | —   | —         |
| ૨૪.     | —           | —                             | —                     | (૮૩)વિભાગીય વડા કે ચીફ ઓફિસરનો વહીવટી રીપોર્ટ.   | —   | —         |

કલમ -૪(૧)(ખ)(૭)

તેની નિતી ઘડતરના અથવા તેના અમલીકરણનાં સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર અને વિનિમય માટે અથવા તેના ધ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ વ્યવસ્થાની વિગતો :-

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે

કલમ -૪(૧)(ખ)(૮)

તેના ભાગ તરીકે અથવા તેની સલાહનાં હેતુઓ માટે બે અથવા બે થી વધુ વ્યક્તિઓનાં બનેલા બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોનું પત્રક, અને તે બોર્ડ, કાઉન્સીલો, સમિતિઓ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ :-

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે.

કલમ -૪(૧)(ખ)(૯) તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :-

| અ.નં. | અધિકારી/કર્મચારીનું નામ<br>કર્મચારી નંબર          | હોદ્દો                                       | સરનામું   | રીમાર્ક્સ                        |
|-------|---|--|---|----------------------------------|
| ૧     | શ્રીમતી ધ્વનિ નરેશભાઈ પટેલ<br>કર્મ.નં.૩૬૪૫        | નાયબ<br>આરોગ્ય<br>અધિકારીશ્રી<br>(સર્વેલન્સ) | ૧૨-એ, આનંદ રો-હાઉસ, આનંદ મહલ<br>રોડ, જૈન વાડી પાસે, શ્રીજી આકેડે,<br>અડાજણ, નવયુગ કોલેજ,<br>સુરત-૩૯૫૦૦૯,<br>મો.નં.૯૦૯૯૦ ૦૭૮૭૫ |                                  |
| ૨     | શ્રી ડૉ. કે. જી. વૈષ્ણવ, કર્મ.નં.૧૭૧૬૫            | જંતુનાશક<br>અધિકારી                          | એ/૭, પ્રથમ રો-હાઉસ, હનીપાર્ક રોડ,<br>સરસ્વતી સ્કુલની પાસે, અડાજણ, સુરત<br>મો.નં. ૯૭૨૪૩ ૪૫૪૮૦                                  |                                  |
| ૩     | શ્રી નરેશકુમાર ભોળાભાઈ સુથાર,<br>કર્મ.નં.૧૯૭૯૬    | એડીશનલ<br>જંતુનાશક<br>અધિકારી                | ૨૦૪, વિદ્યાતા પેલેસ, અલખનંદ સોસાયટી,<br>ન્યુ ભટાર, સુરત-૩૯૫૦૧૭,<br>મો.નં.૯૭૨૪૩ ૪૫૪૮૪  |                                  |
| ૪     | શ્રી જયસુખલાલ પી. વાગડીયા,<br>કર્મ.નં. ૩૪૨૬૪      | એડીશનલ<br>જંતુનાશક<br>અધિકારી                | એ/૧૪૮, મહાલક્ષ્મી સોસાયટી, ચીકુવાડીની<br>બાજુમાં, પુણા-સીમાડા રોડ, પુણા ગામ,<br>સુરત.મો.નં. ૯૭૨૪૩ ૪૫૪૮૫, ૯૭૨૪૩<br>૩૮૬૪૫       |                                  |
| ૫     | શ્રી ગિરીશભાઈ શિવભાઈ કલાલ,<br>કર્મ.નં. ૭૬૮૩૮      | આસીસ્ટન્ટ<br>જંતુનાશક<br>અધિકારી             | ગામ : સાલાવાટા, પો.કર્કલા તહસીલ,<br>સાલુમબર ડી.ઉદયપુર,<br>મો.૮૨૯૦૧ ૦૭૫૧૦  |                                  |
| ૬     | શ્રી નરેશભાઈ કંચનભાઈ વસાવા,<br>કર્મ.નં. ૭૬૮૪૧     | આસીસ્ટન્ટ<br>જંતુનાશક<br>અધિકારી             | એ.પો.બાબડા, તા.ડેડીયાપાડા,<br>જી.નર્મદા-૩૯૩૧૩૦, ડેડીયાપાડા.<br>મો.નં.૯૪૨૮૨ ૭૭૦૪૬  |                                  |
| ૫     | શ્રી સંજયકુમાર રમેશચંદ્ર મેવાલા,<br>કર્મ.નં.૧૮૭૬૦ | સેનેટરી<br>ઈન્સપેક્ટર                        | સી/૫૫-૫૬, સમરપન કો.ઓ.હા.સો.,<br>ચોકસી વાડીની પાસે, અડાજણ, સુરત,<br>મો.નં.૯૮૨૪૭ ૦૨૦૦૧  |                                  |
| ૬     | શ્રી ધનસુખભાઈ મગનભાઈ આહીર,<br>કર્મ.નં.૧૯૬૬૪       | સેનેટરી<br>ઈન્સપેક્ટર                        | કેટેગરી-૨, બ્લોક નં.૧, રૂમ નં.૧, મ્યુ. સ્ટાફ<br>ક્વાર્ટસ, અલથાણ, સુરત. મો.નં.૯૪૨૭૧<br>૨૨૯૭૧                                   | પી.એસ.યુ.<br>લેબમાં ફરજ<br>બજાવે |
| ૭     | શ્રી મેહુલ મનોજકુમાર દેસાઈ,<br>કર્મ.નં.૧૯૭૧૪      | સેનેટરી<br>ઈન્સપેક્ટર                        | બી/૧-૧૦૦૫, ગ્રીન સીટી, ભાઠાગામની<br>પાસે, પાલ, અડાજણ, સુરત. મો.નં.૯૮૯૮૯<br>૯૯૬૪૩  |                                  |

|    |  |                       |  |
|----|--|-----------------------|--|
| ૮  | શ્રી મુકુલકુમાર છોટુભાઈ વશી<br>કર્મ. નં. ૧૯૬૭૯           | સેનેટરી<br>ઈન્સપેક્ટર | એ.પો.છીણમ, વાયા મરોલી બજાર,<br>તા.ઝલાલપોર, ડી.સુરત. ૩૯૬૪૩૬<br>મો.નં.૯૮૨૫૦ ૭૨૫૯૬  |
| ૯  | શ્રી કેયુષકુમાર હર્ષદરાય પટેલ<br>કર્મ. નં. ૩૨૦૩૫         | સેનેટરી<br>ઈન્સપેક્ટર | એ/૧૦૧, સંસ્કૃતિ કોમ્પલેક્ષ, જહાંગીરપુરા,<br>સુરત-૩૯૫૦૦૫ મો.નં.૯૮૨૫૩૬૨૨૯૧   |
| ૧૦ | શ્રી રૂપલબેન ચેતન પંડ્યા<br>કર્મ. નં. ૧૩૬૮૧              | લેબ.<br>ટેકનીશ્યન     | ૧૪૧, દિવાળીબાગ સોસા., રૂષભ એ.પા.<br>પાસે, રાંદેર રોડ, સુરત. મો.નં.૯૮૨૫૯<br>૦૪૯૫૨, ૯૯૨૫૧ ૪૪૮૮૪,<br>૯૯૨૪૭૯૫૮૪૯                     |
| ૧૧ | શ્રી કીર્તિદાબેન હેમતકુમાર ભાટપોરવાલા<br>કર્મ. નં. ૧૯૩૯૭ | લેબ.<br>ટેકનીશ્યન     | એ-૨૩, ગોવર્ધન પાર્ક સોસાયટી, ડી-માર્ટની<br>પાછળ, અડાજણ, સુરત. મો.નં.૯૮૭૯૨<br>૪૪૯૯૬   |
| ૧૨ | શ્રી જાગૃતિબહેન વિકી જોષી<br>કર્મ. નં. ૧૯૩૯૮             | લેબ.<br>ટેકનીશ્યન     | "માવતર" ૭૨, શાંતિકુંજ સોસા., પાલનપુર<br>જકાતનાકા, સુરત. મો.નં. ૯૩૭૪૦<br>૪૩૮૮૪, ૯૩૭૪૭ ૧૮૨૫૪                                       |
| ૧૩ | શ્રી પ્રાચી ગૌરાંગભાઈ વૈદ્ય,<br>કર્મ નં. ૧૯૩૯૯           | લેબ.<br>ટેકનીશ્યન     | "એ"/૫૦૩, નીલકંઠ રેસીડેન્સી,<br>એસ.એમ.સી.પાર્ટી પ્લોટની બાજુમાં ગ્રીન<br>સીટી રોડ, પાલ, સુરત. મો.નં.૯૯૨૫૨<br>૦૭૦૪૯                |
| ૧૪ | શ્રી ચેતનભાઈ દેવશીભાઈ ચૌહાણ, કર્મ.<br>નં. ૧૯૫૧૦          | લેબ.<br>ટેકનીશ્યન     | ૬, વૃંદાવન નગર, ડભોલી ચાર રસ્તા, વેડ<br>રોડ, સુરત. મો.નં. ૮૫૧૧૧ ૭૧૮૩૩  |
| ૧૫ | શ્રીમતી મનીષાબેન અલકેશભાઈ મહેતા,<br>કર્મ.નં. ૧૯૭૪૫       | લેબ.<br>ટેકનીશ્યન     | ૯, શ્રીનગર સોસાયટી, દુરદર્શન ભવન, ઘોડદોડ<br>રોડ, સુરત. મો.નં. ૮૦૦૦૩ ૨૦૩૩૭  |
| ૧૬ | શ્રી કૈલાશબેન જયસુખલાલ કોઠીયા, કર્મ.<br>નં. ૩૦૨૪૫        | લેબ.<br>ટેકનીશ્યન     | ૬૧, ઋષિ બંગ્લોઝ, બોમ્બેમાર્કેટની પાછળ,<br>બોમ્બે માર્કેટ થી પુણાગામ રોડ, સુરત.<br>મો.નં.૯૯૦૯૦ ૦૯૧૩૭                              |
| ૧૭ | શ્રી ધૃતી રાજેશકુમાર વૈદ્ય<br>કર્મ. નં. ૩૨૦૬૩            | લેબ.<br>ટેકનીશ્યન     | બીલ્ડીંગ નં.બી-૨/૧૯, ફ્લેટ નં. ૬૦૧, ગ્રીન<br>સીટી, ભાઠા, સુરત. મો.નં. ૮૪૬૯૫૬૦૬૧૫   |
| ૧૮ | શ્રી મનીષા કેતન દેસાઈ<br>કર્મ. નં. ૩૨૦૭૫                 | લેબ.<br>ટેકનીશ્યન     | બી/૭૦૨, શાલીગ્રામ પાર્ક ટી.જી.બી.હોટેલ<br>પાસે, ગ્રીન એવેન્યુની પાછળ, એલ.પી.સવાણી<br>રોડ, સુરત.<br>મો.નં.૯૯૨૪૩ ૯૯૨૫૯, ૬૩૫૩૦૪૨૨૦૨ |
| ૧૯ | શ્રી નિલમ્બરી સતિષકુમાર પરમાર, કર્મ.<br>નં. ૩૪૦૧૯        | લેબ.<br>ટેકનીશ્યન     | ૪, જાનકી રો-હાઉસ, પિનલ રો-હાઉસની<br>સામે, પાલનપુર પાટીયા, સુરત.<br>મો.નં.૯૬૦૧૨ ૮૭૦૯૫   |
| ૨૦ | શ્રી મેઘાબેન જતિન રેશ્મવાલા<br>કર્મ. નં. ૩૪૭૮૩           | લેબ.<br>ટેકનીશ્યન     | ૧૫, સહજધામ સોસાયટી, ગોવિંદનગરની<br>બાજુમાં હનીપાર્ક રોડ, અડાજણ, સુરત-૯<br>મો.નં. ૯૬૦૧૨ ૮૭૦૭૪                                     |
| ૨૧ | શ્રી ફાલ્ગુની ધર્મેશકુમાર દેસાઈ<br>કર્મ. નં. ૩૫૨૭૬       | લેબ.<br>ટેકનીશ્યન     | ૯૫/બી, સર્જન સોસાયટી, સાઈન્સ સેન્ટર<br>સામે, ન્યુ સીટીલાઈટ રોડ, સુરત.<br>મો.નં.૯૯૦૪૪ ૪૫૦૯૯                                       |
| ૨૨ | શ્રી નેહા ધર્મેશકુમાર પટેલ<br>કર્મ. નં. ૩૫૨૯૮            | લેબ.<br>ટેકનીશ્યન     | બી-૫, શાંતિનિકેતન રો-હાઉસ, સ્નેહ સંકુલ<br>વાડીની સામે, આનંદ મહલ રોડ, સુરત.<br>મો.નં.૯૯૨૫૦ ૩૩૩૬૦                                  |
| ૨૩ | શ્રી નીતાબહેન હરીશભાઈ ચાવડા, કર્મ.<br>નં. ૩૫૫૫૧          | લેબ.<br>ટેકનીશ્યન     | ૧૦, પ્રયોગરાજ રો-હાઉસ પ્રાઈમ માર્કેટ<br>પાસે, આનંદમહલ રોડ, સુરત.<br>મો.નં.૯૮૭૯૬ ૮૬૩૫૫<br>૮૧૪૧૪ ૧૮૨૪૭                             |
| ૨૪ | શ્રી સુમીત્રાબેન બકુલભાઈ ચોડવડીયા,<br>કર્મ. નં. ૩૯૨૭૬    | લેબ.<br>ટેકનીશ્યન     | બી-૧૩, ગોપીનાથ સોસા. સવજી કોરાટ<br>પુલ, મોટા વરાછા, સુરત. મો.નં. ૯૮૭૯૩<br>૮૭૨૩૬  |
| ૨૫ | શ્રી મનીષાબેન તેજસ મોતીવાલા<br>કર્મ. નં. ૪૦૧૫૭           | લેબ.<br>ટેકનીશ્યન     | ૧૦૩, સીધીગીરી ટાવર, નવયુગ કોલેજની<br>પાછળ, રાંદેર રોડ, સુરત. મો.નં.૯૯૭૯૯<br>૨૩૩૩૧, ૯૯૭૯૩ ૮૭૨૩૬                                   |

|    |  |                           |   |                                  |
|----|--|---------------------------|---|----------------------------------|
| ૨૬ | શ્રી માનસી સાવનકુમાર પટેલ<br>કર્મ. નં. ૪૦૧૫૮             | લેબ.<br>ટેકનીશ્યન         | ડી-૩૬/૩૭, કિશોરપાર્ક સોસા., સેન્ટ ઝવીયર<br>સ્કુલની પાછળ, ઘોડદોડ રોડ, સુરત.<br>મો.નં.૯૯૭૮૯ ૧૩૩૯૮, ૯૭૭૩૦<br>૫૧૩૦૧ |                                  |
| ૨૭ | શ્રી રૂપલ પિયુષ ગજજર<br>કર્મ. નં. ૪૦૪૭૨                  | લેબ.<br>ટેકનીશ્યન         | ૪૦૪, દેવ ભુમી એ.પા.સરદાર બ્રીજની<br>નજીક, અડાજણ, સુરત. મો.નં.૯૮૨૪૭<br>૮૫૮૪૯                                     |                                  |
| ૨૮ | શ્રી ફાલ્ગુની સમીર પટેલ<br>કર્મ. નં. ૪૦૪૭૬               | લેબ.<br>ટેકનીશ્યન         | બી/૧૧૯, આશીષ રો.હાઉસ, જહાંગીરપુરા,<br>વરીયાવ-રોડ, સુરત. મો.નં.૯૮૭૯૧<br>૦૬૪૪૦                                    | પી.એસ.યુ.<br>લેબમાં ફરજ<br>બજાવે |
| ૨૯ | શ્રી બીનાબેન બાબુલાલ પટેલ,<br>કર્મ નં. ૭૪૨૧૪             | તા.લેબોરેટરી<br>ટેકનીશીયન | ગામીના દેલા પાસે, સંડેર,<br>તા.જિ.પાટણ-૩૮૪૨૭૫.<br>મો.નં.૯૦૧૬૮૬૭૬૫૦  |                                  |
| ૩૦ | શ્રી સુરભી ઘીરજલાલા કાકોલતરા<br>કર્મ નં. ૭૪૨૩૩           | તા.લેબોરેટરી<br>ટેકનીશીયન | ૮૮, જે. કે.પી. નગર, કતારગામ, સિંગણપોર,<br>સુરત. મો.નં. ૭૮૧૮૯ ૮૨૦૮૨  |                                  |
| ૩૧ | શ્રી પરેશ કે. ઠાકર<br>કર્મ નં. ૭૪૪૫૨                     | તા.લેબોરેટરી<br>ટેકનીશીયન | ૨૫, માધવપાર્ક, માણસા, માનસ, ગાંધીનગર,<br>ગુજરાત-૩૮૨૮૪૫,<br>મો.નં.૯૫૫૮૮ ૭૧૬૪૭                                    |                                  |
| ૩૨ | શ્રી ચૈતાલીબહેન વિનોદકુમાર ટેલર<br>કર્મ નં. ૭૬૮૧૭        | તા.લેબોરેટરી<br>ટેકનીશીયન | બી-૨૦૩, સંગીની ગાર્ડન, દાંડી રોડ, સુભાષ<br>ગાર્ડનની પાસે, જહાંગીરબાદ,<br>સુરત-૩૯૫૦૦૫. મો.નં.૯૬૮૭૫૭૭૪૦૯          |                                  |
| ૩૩ | શ્રી રાજદિપસિંહ રતનસિંહ ખેર<br>કર્મ નં. ૭૬૮૧૮            | તા.લેબોરેટરી<br>ટેકનીશીયન | ૨૧૫/૨૧૬, ઈન્ડીરા નગર વીઆઈપી-૨,<br>પૂર્વી સોસાયટીની પાસે, વરાછા રોડ,<br>સુરત-૩૯૫૦૦૬, મો.નં.૯૯૯૮૮૯૧૮૦૯            |                                  |
| ૩૪ | શ્રી જયેશકુમાર હસમુખભાઈ નાયક, કર્મ.<br>નં. ૧૯૪૦૨         | સેનેટરી સબ<br>ઈન્સ્પેક્ટર | મુ.પો.નિયોલ, તા.પલસાણા, જી. સુરત<br>મો.નં.૯૭૨૪૩ ૩૧૮૭૪   |                                  |
| ૩૫ | શ્રી સુનિલ બી. પટેલ<br>કર્મ. નં. ૩૪૪૪૪                   | સેનેટરી સબ<br>ઈન્સ્પેક્ટર | બી-૩૦૪, એસએમસી ક્વાર્ટસ ભટાર,<br>સુરત-૩૯૪૨૧૦  | કોસાડ યુનિટ<br>ખાતે ફરજ<br>બજાવે |
| ૩૬ | શ્રી વિપુલકુમાર મનહરલાલ સોલંકી, કર્મ.<br>નં. ૩૯૩૦૪       | સેનેટરી સબ<br>ઈન્સ્પેક્ટર | ૫૦૬, ગાર્ડન હાઈટસ એપાર્ટમેન્ટ, સહજ<br>સુપર સ્ટોર પાસે, આનંદ મહેલ રોડ,<br>અડાજણ, સુરત. મો.નં.૯૭૧૪૯૪૯૦૦૦          |                                  |
| ૩૭ | શ્રી કલ્પેશકુમાર કાંતિલાલ પટેલ<br>કર્મ. નં. ૪૭૬૩૧        | ત્રીજી શ્રેણી<br>ક્લાર્ક  | મુ. પો. અણીતા, બ્રાહ્મણ ફળિયું, વાયા. કીમ<br>તા. ઓલપાડ, જી. સુરત ૩૯૪૧૧૦,<br>મો.નં. ૭૩૫૯૯૧૮૨૮૩                   |                                  |
| ૩૮ | શ્રીમતી કુસુમબેન મહેશભાઈ પટેલ, કર્મ.<br>નં. ૪૭૬૩૨        | ત્રીજી શ્રેણી<br>ક્લાર્ક  | મુ. પો. વરિયાવ, બ્રાહ્મણ ફળિયું, તા.ચોયાસી,<br>જી.સુરત-૩૯૪૫૨૦.<br>મો.નં.૯૯૭૯૪૬૩૭૭૯                              |                                  |
| ૩૯ | શ્રી પ્રજોશકુમાર જીતેન્દ્રભાઈ સોલંકી, કર્મ.<br>નં. ૪૭૮૭૧ | ત્રીજી શ્રેણી<br>ક્લાર્ક  | ડી-૯, સાર્થક રો-હાઉસ, પાલનપુર<br>જકાતનાકા, મીની વિરપુર રોડ, સુરત-<br>૩૯૫૦૦૯, મો.નં.૯૯૭૯૮૯૧૦૪૮૫                  |                                  |
| ૪૦ | શ્રી ભાવિનકુમાર વિનોદચંદ્ર પંચાલ, કર્મ.<br>નં. ૪૮૦૦૫     | ત્રીજી શ્રેણી<br>ક્લાર્ક  | એચ-૬૦૩, અવન્ટીકા કો.ઓ.સો.,<br>પ્રગતિનગર, પીપલોડ જકાતનાકા, પીપલોડ,<br>સુરત-૩૯૫૦૦૧, િ.નં.૯૯૦૯૦૭૯૫૫૭               |                                  |
| ૪૧ | શ્રી વિજયકુમાર લક્ષ્મીદાસ ટાંક<br>કર્મ. નં. ૪૮૨૦૮        | ત્રીજી શ્રેણી<br>ક્લાર્ક  | આઈ-૪૦૪, સ્વર્ગ રેસીડેન્સી, પાસોદરા<br>પાટીયા, ખોલવડ રોડ, ખોલવડ.<br>મો.નં.૯૬૬૨૭ ૪૭૨૬૦                            |                                  |
| ૪૨ | શ્રીમતી તન્વીબેન વિજયસિંહ ઠાકોર, કર્મ.<br>નં. ૪૯૧૫૫      | ત્રીજી શ્રેણી<br>ક્લાર્ક  | જે-૨૦૩, અંજની રેસીડેન્સી, ઈસ્કોન મંદિરની<br>સામે, જહાંગીરપુરા, સુરત. મો.નં.૯૯૨૫૬<br>૧૫૫૧૪                       |                                  |
| ૪૩ | શ્રી રમેશકુમાર રામશંકર ત્રિવેદી<br>કર્મ. નં. ૩૪૦૫૭       | ડ્રાયવર                   | એફ/૫૦૨, સ્વસ્તિક એવેન્યુ, એલ.પી.સવાણી<br>સ્કુલ પાસે. નક્ષત્રની બાજુમાં પાલ રોડ, સુરત.<br>મો.નં.૯૪૨૮૮૪૨૯૭૯       |                                  |

|    |  |              |   |   |
|----|--|--------------|---|---|
| ૪૪ | શ્રી જયેશકુમાર શાંતિલાલ પવાર<br>કર્મ. નં. ૪૦૫૫૨          | ડ્રાયવર      | એ-૨-૨૩, શ્રી સાંઈ કૃપા પાર્ક એપાર્ટમેન્ટ,<br>અલથાણા રોડ, શ્રી રામ મારબલની પાસે,<br>સુરત-૩૯૫૦૧૭. મો.૯૯૧૩૭૨૮૩૯૦ | વેકસીનેશન<br>બ્રાંચમાં ફરજ<br>બજાવે                 |
| ૪૫ | શ્રી ઈશ્વરલાલ જયંતિલાલ પટેલ, કર્મ.<br>નં. ૪૦૮૮૦          | ડ્રાયવર      | જતીસાથ મહોલ્લો, મુ.દિહેણ,તા.ઓલપાડ<br>જિ. સુરત.મો.નં.૯૯૦૯૬૬૫૩૪૫  |   |
| ૪૬ | શ્રી પ્રકાશકુમાર સુમંતરાય રાવલ, કર્મ.<br>નં. ૧૯૪૪૯       | પ્રા.હે. વ.  | ગાયત્રી નગર, વિજલપુર રોડ, નવસારી.<br>૯૮૨૫૮૩૧૮૪૮   | સ્મીમેર<br>હોસ્પીટલ ખાતે<br>ફરજ બજાવે               |
| ૪૭ | શ્રી શૈલેન્દ્રકુમાર છોટાલાલ વાડીવાલા, કર્મ.<br>નં. ૧૯૪૭૩ | પ્રા. હે. વ. | ૨૦૧, પાર્થ કોમ્પ્લેક્ષ, તાડવાડી, ન્યુ રાંદેર<br>રોડ, સુરત-૩૯૫૦૦૯. મો.નં.૯૮૭૯૦<br>૬૨૨૪૯                        | ઉમરવાડા યુનિટ<br>(સેન્ટ્રલઝોન)<br>ખાતે ફરજ<br>બજાવે |
| ૪૮ | શ્રી રવિન્દ્રકુમાર મોહનલાલ પટેલ, કર્મ.<br>નં. ૧૯૮૬૫      | પ્રા. હે. વ. | બી-૩, ૩૦૨, સુર્યાજલી રેસીડેન્સી, ક્રોસ રોડ,<br>કોસાડ, સુરત-૩૯૪૧૦૭.<br>મો.નં.૯૭૨૪૩૧૯૮૨૨                        |   |
| ૪૯ | શ્રી કમલેશકુમાર ઈશ્વરભાઈ ઢીમ્મર,<br>કર્મ.નં.૩૪૩૯૬        | પ્રા. હે. વ. | એ.પો.નિહાલી, ધોળીકુઈ, પંચાયત હાઉની<br>પાછળ, તા.મહુવા, ડી.સુરત-૩૯૪૨૫૦,<br>મો.નં.૯૧૭૩૦૯૯૬૧૫                     |   |
| ૫૦ | શ્રી પ્રવિણસિંહ ભીખુસિંહ પરમાર, કર્મ.<br>નં. ૩૪૪૩૧       | પ્રા. હે. વ. | એ/૨૦૭, શ્રીજી કોમ્પ્લેક્ષ, જીઆવ બુડીયા<br>રોડ, ભેસ્તાન બસ સ્ટેન્ડ પાસે, સુરત<br>૩૯૫૦૨૩, મો.નં.૯૭૨૪૩૩૨૪૮૭      | સ્મીમેર<br>હોસ્પીટલ ખાતે<br>ફરજ બજાવે               |
| ૫૧ | શ્રી અજીત પાનીયાભાઈ ગામીત<br>કર્મ. નં. ૩૪૪૩૪             | પ્રા. હે. વ. | ૫૩૫, મહાદેવ નગર-૧, નવાગામ, ડીડોલી,<br>ઉધના સુરત. ૩૯૪૨૧૦ મો.નં.૯૬૦૧૨<br>૮૬૬૪૫                                  |   |
| ૫૨ | શ્રી મોહમદઆરીફ જી. મન્સુરી<br>કર્મ. નં. ૩૪૪૩૫            | પ્રા. હે. વ. | ૪/૩૦૨૩, બેગમપુરા અહંમદ નબીલ સ્ટ્રીટ,<br>સુરત ૩૯૫૦૦૩. મો.નં. ૮૫૧૧૧ ૦૬૦૫૮                                       | પાંડેસરા યુનિટ<br>ખાતે ફરજ<br>બજાવે                 |
| ૫૩ | શ્રી સુનિલભાઈ ખુશાલભાઈ પટેલ, કર્મ.<br>નં. ૩૪૪૫૬          | પ્રા. હે. વ. | એ-૧૧, શાંતિનગર રોડ, માનેત્ર હોસ્પિટલની<br>સો, બારડોલી ૩૯૪૬૦૧.<br>મો.નં.૯૯૨૫૨૨૩૦૨૬                             |   |
| ૫૪ | શ્રી જેમ્સ જોન મેકવાન<br>કર્મ. નં. ૩૪૪૬૦                 | પ્રા. હે. વ. | જેમ્સ વીલા, પંચ ફાનસ તોસ્ટ ઓફિસ,<br>કોનવેન્ટ સ્કુલની સામે, એસ.ટી. રોડ,<br>ભરૂચ-૩૯૨૧૦૧ મો.નં.૯૭૨૭૨<br>૨૦૦૦૪    |   |
| ૫૫ | શ્રી સંદિપકુમાર સરદભાઈ નાયક,<br>કર્મ. નં.૩૪૬૫૨           | પ્રા. હે. વ. | એ.પો. પોંસરા, મોભ ફળીયા, તા. જલાલપોર<br>જી. નવસારી. મો.નં.૯૮૭૯૦૬૯૪૯૪  | હુંભાલ સ્ટોર<br>ખાતે ફરજ<br>બજાવે                   |
| ૫૬ | શ્રી કૌશિકભાઈ જગદીશભાઈ દેસાઈ, કર્મ.<br>નં.૩૪૮૫૨          | પ્રા. હે. વ. | મુ.પો. મોતા, તા. બારડોલી, જી. સુરત<br>મો.નં.૯૮૨૫૧ ૨૭૫૪૬   | હુંભાલ સ્ટોર<br>ખાતે ફરજ<br>બજાવે                   |
| ૫૭ | શ્રીમતી સેજલ સુનિલકુમાર પટેલ,<br>કર્મ. નં.૪૦૪૯૪          | પ્રા.હે.વ    | પોલ સ્ટ્રીટ,સરી બુજરંગ<br>પો.અમલસાડ,તા.ગણદેવી,જી.નવસારી<br>૩૯૬૩૧૦. મો.નં ૮૫૧૧૧૬૮૩૯૫                           |   |
| ૫૮ | શ્રી ચેતન પ્રકાશ મહાજન<br>કર્મ. નં.૪૫૮૬૩                 | પ્રા.હે. વ.  | ડી/૮૨/૪, સરસ્વતી સોસાયટી-૩, શારદા<br>સ્કુલની પાસે, સિંગણપોર કોઝવે રોડ,<br>સુરત-૩૯૫૦૦૪, મો.નં.૮૧૪૧૩ ૮૭૨૪૪      |   |
| ૫૯ | શ્રી બ્રિજેશકુમાર અશોકભાઈ ગામીત,<br>કર્મ. નં.૪૫૯૩૭       | પ્રા.હે. વ.  | એ-૪, અંબિકા નગર, એ.પો.તાડકુવા,<br>તા.વ્યારા, જી.તાપી-૩૯૪૬૫૦<br>મો.નં.૯૫૩૭૨૧૬૨૧૧, ૭૦૧૬૨૮૬૬૯૪                   |   |
| ૬૦ | શ્રી સતિશભાઈ પ્રતાપભાઈ પરમાર, કર્મ.<br>નં.૪૫૯૩૮          | પ્રા.હે. વ.  | ૧૦૭, ધિરજપાર્ક પાર્ક એપાર્ટમેન્ટ, રૂમ નં<br>-૩, દેસાઈ ફળીયું, ઉધના ગામ, સુરત. ,<br>મો.નં.૯૦૮૧૪૧૦૬૮૬           |   |
| ૬૧ | શ્રી સુરસિંહ જવાનસિંહ સોલંકી<br>કર્મ. નં. ૪૫૯૩૯          | પ્રા.હે. વ.  | ૭૯, વિનાયકનગર ગેટ નં.૨, ૧૨૦ ફુટ<br>બમરોલી રોડ, પાંડેસરા, સુરત. મો.નં.<br>૭૩૫૯૬૪૦૨૬૬                           | સ્મેક સેન્ટર<br>(આઈ.એસ.ડી)<br>ખાતે ફરજ              |

|    |  |             |   | બજાવે                        |
|----|--|-------------|---|------------------------------|
| ૬૨ | શ્રી હર્ષદભાઈ ઘીરુભાઈ મકવાણા, કર્મ. નં. ૪૫૯૪૧          | પ્રા.હે. વ. | ૩૩-બી, ધ્રુવતારક સોસા., વેડરોડ, કતારગામ, સુરત. મો. નં. ૭૬૯૮૭ ૩૭૬૭૨  |                              |
| ૬૩ | શ્રી મુકેશભાઈ અર્જુનભાઈ પગી કર્મ. નં. ૪૫૯૪૨            | પ્રા.હે. વ. | ઘર નં. ૨૩૪, અરૂણોદય સોસા., બમરોલી રોડ, પાંડેસરા, સુરત. મો. નં. ૯૫૧૦૫૭૭૨૫૬   |                              |
| ૬૪ | શ્રી ભારતીબેન નિતિનકુમાર સોલંકી, કર્મ. નં. ૪૫૯૪૪       | પ્રા.હે. વ. | જે-૩, પંચશીલ એપાર્ટમેન્ટ, અલાયાની વાડી, મહીધરપુરા, સુરત. મો. નં. ૯૬૮૭૧૯૭૬૪૧   |                              |
| ૬૫ | શ્રી વિપુલભાઈ મકોડભાઈ જોષી, કર્મ. નં. ૪૫૯૪૫            | પ્રા.હે. વ. | ઘર નં. ૧૪૫, વર્ષા સોસા.-૧, માતાવાડી, વરાછા, સુરત. મો. નં. ૯૭૨૫૨૧૩૦૫૧  |                              |
| ૬૬ | શ્રી પંકિતકુમાર શરદભાઈ નાયક, કર્મ. નં. ૪૮૫૨૫           | પ્રા.હે. વ. | સી-૩૦૨, સંગીની ગાડનીયા, દાંડી રોડ, જહાંગીરાબાદ, સુરત. મો. નં. ૯૫૩૭૫ ૮૬૭૧૨   |                              |
| ૬૭ | શ્રી તેજશકુમાર રમણભાઈ ટંડેલ કર્મ. નં. ૪૮૫૪૦            | પ્રા.હે. વ. | મુ. પો. : ભાગલ, તો. જી. વલસાડ (મંદિર ફળિયા) પીન કોડ નં. ૩૯૬૩૮૫. મો. નં. ૮૭૮૦૬૬૨૧૯૪                                  |                              |
| ૬૮ | શ્રી હિરણકુમાર અર્જુનસિંહ ઠાકોર, કર્મ. નં. ૪૮૫૪૧       | પ્રા.હે. વ. | મુ: બલકસ, પોસ્ટ, ચોચડ, તા. ઓલપાડ, જી. સુરત પીન નં. ૩૯૪૫૪૦ મો. નં. ૯૭૨૩૯૧૮૪૦૫, ૯૬૨૪૬૬૭૧૬૪                            |                              |
| ૬૯ | શ્રી સહદેવ અંબાલાલ પઢીયાર કર્મ. નં. ૪૮૫૪૨              | પ્રા.હે. વ. | ૧૨૧, શકિતનગર સોસા., ભરથાણા (કોસાડ) તા. ચોયાંસી, જી. સુરત, પીન નં. ૩૯૪૧૦૭, મો. નં. ૯૭૩૭૧૮૫૫૮૦                        |                              |
| ૭૦ | શ્રી રોબિનકુમાર રમેશભાઈ પટેલ, કર્મ. નં. ૪૮૫૪૩          | પ્રા.હે. વ. | ખેડવાયા સ્ટ્રીટ, નવા મગદલા, ડુમસ રોડ, સુરત, પીન નં. ૩૯૫૦૦૭. મો. નં. ૯૭૨૫૦૪૧૦૯૮, ૭૫૬૭૨૨૧૮૬૧                          |                              |
| ૭૧ | શ્રી ઉર્મિલાબેન નરેન્દ્રકુમાર પરમાર, કર્મ. નં. ૪૮૫૪૪   | પ્રા.હે. વ. | ૨/૨૭૧૩ ગીતાનગર, નડીયાવાસ, સગરામપુરા પુતળી, સુરત. મો. નં. ૯૮૯૮૯૭ ૩૨૩૨૧   |                              |
| ૭૨ | શ્રી અંકિતભાઈ ચીમનભાઈ મહેતા કર્મ. નં. ૪૮૫૪૫            | પ્રા.હે. વ. | મુ. બીલખડી, પટેલ ફળિયા, તા. મહેવા જી. સુરત, મો. નં. ૭૯૯૦૪૭૮૧૫૭, ૮૧૪૦૫૪૨૪૫૮  |                              |
| ૭૩ | શ્રી ઘર્મેન્દ્રકુમાર નરેન્દ્રભાઈ જોષી, કર્મ. નં. ૪૮૫૪૬ | પ્રા.હે. વ. | ઘર નં. ૭૨/બી, જલારામ નગર, છત્રપતી શિવાજી સ્કુલની પાસે, હરિનગર-૧, ઉધના, સુરત. મો. નં. ૯૯૧૩૨૧૫૨૫૦, ૮૧૫૫૦૦૬૫૭૦         |                              |
| ૭૪ | શ્રી શૈલેષભાઈ વીસાભાઈ ચુડાસમા, કર્મ. નં. ૪૮૫૪૭         | પ્રા.હે. વ. | ઘર નં. ૯, સોહમ એપાર્ટ., શ્યામ નગર સોસા., નવાગામ, કામરેજ ચાર રસ્તા, પીન નં. ૩૯૫૦૦૭. મો. નં. ૯૭૨૪૦૨૩૮૩૬               |                              |
| ૭૫ | શ્રી સૌરભ વિનોદભાઈ પટેલ કર્મ. નં. ૪૮૫૪૮                | પ્રા.હે. વ. | ફ્લેટ નં. ૫, અશોક એપાર્ટ, કૃષ્ણકુંજ સોસા., પાલનપુર પાટીયા, સુરત. મો. નં. ૭૩૮૩૪૬૭૮૦૨                                 |                              |
| ૭૬ | શ્રી માલદે વજરાંગભાઈ વાઢીયા કર્મ. નં. ૪૮૫૪૯            | પ્રા.હે. વ. | ઘર નં. ૭, સોહમ એપાર્ટ, શ્યામનગર સોસા., નવાગામ, કામરેજ ચાર રસ્તા, પીન કોડ નં. ૩૯૫૦૦૭, મો. નં. ૮૧૪૧૮૭૮૩૯૭, ૯૨૬૫૫૪૪૯૦૧ |                              |
| ૭૭ | શ્રી ભરતકુમાર શાંતિલાલ નાઈ કર્મ. નં. ૪૮૫૮૬             | પ્રા.હે. વ. | ૭૮, શિવશક્તિ સોસાયટી, રણુજાધામ સોસાયટીની પાસે, બોમ્બેમાર્કેટ થી પુણાગામ રોડ, સુરત-૩૯૫૦૧૦ મો. નં. ૯૭૨૬૯ ૭૬૭૪૪        |                              |
| ૭૮ | શ્રી દિવ્યેશકુમાર ભરતભાઈ પટેલ, કર્મ. નં. ૮૮૮૯૨         | પટાવાળા     | ૫૬, પટેલ ફળિયું, મુ. પો. કસાદ, તા. ઓલપાડ, જી. સુરત. મો. નં. ૭૫૬૭૨૧૯૯૯૮  |                              |
| ૭૯ | શ્રી અરૂણ ગોવિંદભાઈ શર્મા કર્મ. નં. ૧૪૦૨૮              | બેલદાર      | ૧૧૯, રણછોડજી પાર્ક સોસાયટી, કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે, કતારગામ, સુરત. મો. નં. ૯૪૨૬૭૭૪૬૨૭                         | પી. એસ. યુ. લેબમાં ફરજ બજાવે |

|    |  |                      |  |                                   |
|----|--|----------------------|--|-----------------------------------|
| ૮૦ | શ્રી નરેશભાઈ ચીમનલાલ વૈઘ<br>કર્મ.નં.૧૪૦૭૮              | બેલદાર               | ૧૨૧, સાઈઆશિષ સોસાયટી, ઉત્રાણ<br>સ્ટેશનની સામે, જુનો કોસાડ રોડ, અમરોલી,<br>મો.નં. ૭૫૬૭૧ ૪૬૪૫૯, ૯૭૧૨૫<br>૨૯૯૦૯                         | ડુંભાલ સ્ટોર<br>ખાતે ફરજ<br>બજાવે |
| ૮૧ | શ્રી અશ્વિનકુમાર નટવરલાલ પટેલ,<br>કર્મ.નં.૧૭૬૮૮        | બેલદાર               | ૩૦૬, અમીધારા એપાર્ટમેન્ટ, રઘુવીર<br>સોસાયટી, કોસાડ રોડ, અમરોલી મો.નં.<br>૯૯૨૫૨ ૯૯૦૫૭, ૯૯૨૫૨ ૯૯૦૫૭                                    | પી.એસ.યુ.<br>લેબમાં ફરજ<br>બજાવે  |
| ૮૨ | શ્રી રણજીતભાઈ રવિયાભાઈ પટેલ,<br>કર્મ.નં.૧૮૬૯૧          | બેલદાર               | હાટ ફળિયું, ફલધરા, તા.જી.વલસાડ<br>મો.નં. ૮૧૪૦૩ ૦૭૪૦૦   | ડુંભાલ સ્ટોર<br>ખાતે ફરજ<br>બજાવે |
| ૮૩ | શ્રી વિનોદભાઈ રૂડાભાઈ વીરાસ, કર્મ.નં.<br>૩૪૧૦૮         | બેલદાર               | બી-૪-૧૦૮, ગોતાલાવાડી, ટેનામેન્ટ,<br>કતારગામ, સુરત. મો.નં.૯૪૨૮૪ ૫૨૬૫૪   |                                   |
| ૮૪ | શ્રી નીતીનભાઈ મુળજીભાઈ હરીજન,<br>કર્મ.નં. ૩૮૦૪૧        | બેલદાર               | ૧૯, દુર્લભનગર, નવાગામ, ડીડોલી<br>રોડ, ઉધના, સુરત. મો.નં.૯૭૨૪૦ ૮૦૩૨૨,<br>૯૯૮૦૧ ૧૧૪૮૭  |                                   |
| ૮૫ | શ્રી અમિતકુમાર દલસુખભાઈ વાઘેલા,<br>કર્મ.નં.૩૮૧૦૫       | બેલદાર               | ૮૪, મહેશ્વરીપાર્ક સોસા.પરવટ ગામ,<br>ગોડાદરા રોડ, બોમ્બે માર્કેટ, સુરત. મો.નં.<br>૬૩૫૨૭૧૨૭૦૩  |                                   |
| ૮૬ | શ્રી વિનોદ ડાહ્યાભાઈ બારોટ<br>કર્મ.નં. ૩૯૫૦૨           | બેલદાર               | ૨૫, હરીદર્શન સોસાયટી, નવો કોસાડ રોડ,<br>અમરોલી, સુરત. મો.નં.૯૯૭૯૦ ૪૪૬૭૫  | જાહેર ઓરોગ્ય<br>ખાતુ              |
| ૮૭ | શ્રી અજયકુમાર ચંપકલાલ ટેન્યા<br>કર્મ.નં. ૪૨૭૨૫         | બેલદાર               | ૫૨- રામપુરા ગાર્ડન મીલની સામે, કાજીપુરા<br>, યુમ્માલીસ ચાલ, હરિજન વાસ, સુરત<br>મો.નં. મો.નં.૯૯૭૯૦ ૯૧૮૩૨                              | પી.એસ.યુ.<br>લેબમાં ફરજ<br>બજાવે  |
| ૮૮ | શ્રી દર્શવકુમાર રમણીકભાઈ રગાંણી. કર્મ<br>નં. ૬૦૩૮૪     | બેલદાર               | ૪૩, કૃષ્ણ નગર સોસાયટી, અખંડઆનંદ<br>કોલેજની પાસે, વેડ રોડ, સુરત-૩૯૫૦૦૪<br>મો.નં. ૬૩૫૧૬૧૫૯૫૦   |                                   |
| ૮૯ | શ્રી ભાવેશ રમેશચંદ્ર અજમેરી<br>કર્મ નં. ૬૦૪૨૭          | બેલદાર               | ૬૯, ગીરનાર સોસાયટી, છાપરાભાઠા,<br>અમરોલી, સુરત- ૯૪૧૦૭.મો.નં.૯૭૨૬૯<br>૯૯૩૩૨, ૬૩૫૨૭ ૦૬૩૯૯  |                                   |
| ૯૦ | શ્રી અવિનાશ શિવાજી પાટીલ<br>કર્મ નં. ૬૦૪૪૬             | બેલદાર               | ૫૮, મહાપ્રભુનગર, સર્વે નં.૨૧/૨, સેવન-૩<br>સ્કુલની ગલીમાં, લીબાયત, સુરત.<br>મો.નં.૯૨૬૫૦ ૮૭૮૦૧,<br>મો.નં.૯૭૨૨૪ ૮૨૨૩૮                   |                                   |
| ૯૧ | શ્રી પંકજભાઈ નરસિંહભાઈ પટેલ કર્મ નં.<br>૬૦૪૫૨          | બેલદાર               | એએ-૨૩, સાઈ રેસીડેન્સી, દિવા રોડ,<br>અંકલેશ્વર. ૯૯૦૯૯ ૪૩૮૫૨   |                                   |
| ૯૨ | શ્રી સુનીલ રઘુનાથ પવાર<br>કર્મ નં. ૬૦૪૬૨               | બેલદાર               | ૮૧, ગલી નં.૨, સિદ્ધાથ નગર, તનુ ગેસ<br>એજેન્સીની પાસે, ભેસ્તાન નહેર, જીઅવ,<br>ભેસ્તાન, સુરત-૩૯૫૦૨૩.મો.નં. ૮૮૬૬૫<br>૨૧૨૬૫, ૯૭૭૩૦ ૮૦૩૦૮ |                                   |
| ૯૩ | શ્રી વૃંષાકકુમાર વિજયકુમાર ખરસાડીયા,<br>કર્મ નં. ૬૦૪૭૨ | બેલદાર               | ૫/૧૨૫, એ-બ્રાહમણ ફળિયુ, રાંદેર<br>જીમખાના, સુરત-૩૯૫૦૦૫.<br>મો.નં.૯૫૧૦૫ ૭૦૭૪૭, ૮૨૦૦૭<br>૯૪૯૧૪   |                                   |
| ૯૪ | શ્રી વિશાલકુમાર ધનરાજભાઈ પટેલ, કર્મ<br>નં. ૬૦૪૭૬       | બેલદાર               | ૧/૨૬, પ્રજાપતિ મહોલ્લો, મોટી વેડ, સુરત<br>સીટી, સુરત-૩૯૫૦૦૪ મો.નં.૯૭૧૨૯<br>૪૭૪૧૪,<br>૯૧૬૦૪ ૪૫૮૮૩                                     |                                   |
| ૯૫ | શ્રી પ્રશાંતકુમાર ગૌતમભાઈ શિંદે કર્મ નં.<br>૬૨૮૬૧      | તાલીમાર્થી<br>બેલદાર | ૩૨૬, ઈન્દીરાનગર ઝુપડપટ્ટી, ભટાર, સુરત.<br>મો.નં. ૮૭૫૮૮૯૪૦૧,<br>૮૫૧૧૯૬૬૩૫૫  |                                   |
| ૯૬ | શ્રી સાગર મધુકર પાનપાટીલ<br>કર્મ નં. ૬૨૮૬૪             | તાલીમાર્થી<br>બેલદાર | ૨૪૧-મહાદેવનગર સોસાયટી,<br>નવાગામ-ડીડોલી, સુરત મો.નં.<br>૯૯૬૬૨૮૦૮૨૧   |                                   |
| ૯૭ | મોહમદ કાસિમ અખત્યારહુસેન કાદીર કર્મ<br>નં. ૬૨૮૬૫       | તાલીમાર્થી<br>બેલદાર | બી-૧૫, શુકુન ટેનામેન્ટ, અલફેસાની સ્કુલ<br>પાસે, ન્યુ રાંદેર રોડ, સુરત.મો.નં. ૭૦૯૬૫   |                                   |

|     |  |                      |  |                                       |
|-----|--|----------------------|--|---------------------------------------|
|     |  |                      | ૮૦૦૮૩  |                                       |
| ૯૮  | શ્રી અબ્દુલસાજીદ અઝીઝ શેખ<br>કર્મ નં. ૬૨૮૬૯        | તાલીમાર્થી<br>બેલદાર | ૩/૩૦૨૪, અકબર શહીદ, પઠાણવાડ,<br>રૂસ્તમપુરા પોલીસ થોકી પાસે, સુરત. મો.નં.<br>૭૩૮૩૫૩૩૦૫૦                    |                                       |
| ૯૯  | શ્રી પ્રિયાંશુ યોગેશ મોરે<br>કર્મ નં. ૬૩૧૩૭        | તાલીમાર્થી<br>બેલદાર | ૯૨/૯૩, માધવપાર્ક રો-હાઉસ, પાલનપુર<br>જકાતનાકા, અડાજણ, સુરત-૩૯૫૦૦૫<br>મો.નં. ૭૪૦૫૧૫૫૩૭૬                   |                                       |
| ૧૦૦ | શ્રી અનિલ અમરસીંગ વસાવા<br>કર્મ નં. ૭૪૩૦૫          | તાલીમાર્થી<br>બેલદાર | ૨૦, આંબેડકરનગર, વરીયાવ, તાડવાડી,<br>સુરત-૩૯૪૫૨૦, મો.નં. ૯૭૨૭૫ ૧૧૨૭૭                                      | ડુંભાલ સ્ટોર<br>ખાતે ફરજ<br>બજાવે     |
| ૧૦૧ | શ્રી આકાશ નરેશભાઈ પટેલ<br>કર્મ નં. ૭૪૩૦૯           | તાલીમાર્થી<br>બેલદાર | ૭૩, ઝુલા ફળિયુ, વેડ ડભોલી,<br>સુરત-૩૯૫૦૦૪ મો.નં. ૮૨૦૦૦૪૨૬૬૭  | પી.એસ.યુ.<br>લેબમાં ફરજ<br>બજાવે      |
| ૧૦૨ | શ્રી મેઘાબેન શૈલેષકુમાર પટેલ<br>કર્મ નં. ૭૪૩૧૪     | તાલીમાર્થી<br>બેલદાર | ૮૬, લુહાર ફળિયુ, નિશાળ ફળિયુ, સોંસક,<br>સુરત.<br>મો.નં. ૯૫૩૭૫ ૨૯૪૫૬                                      |                                       |
| ૧૦૩ | શ્રી હેતલબેન ચંદ્રકાંતભાઈ પટેલ<br>કર્મ નં. ૭૪૩૧૭   | તાલીમાર્થી<br>બેલદાર | ૪, સરદાર નગર, પટેલ નગર સોસાયટી,<br>ડભોલી રોડ, સુરત-૩૯૫૦૦૪<br>મો.નં. ૯૯૭૯૩ ૯૯૭૯૩                          |                                       |
| ૧૦૪ | શ્રી જીગ્નેશ દિનેશકુમાર પરમાર<br>કર્મ નં. ૭૪૩૨૧    | તાલીમાર્થી<br>બેલદાર | ૪૪, એસ.એમ.સી. ક્વાર્ટસ છપ્પન ચાલ,<br>રૂદરપુરા, સુરત. મો.નં. ૮૪૦૧૬૭૨૮૯૮                                   | પી.એસ.યુ.<br>લેબમાં ફરજ<br>બજાવે      |
| ૧૦૫ | શ્રી સંજયકુમાર ધીરુભાઈ વાઘેલા<br>કર્મ નં. ૭૪૩૨૪    | તાલીમાર્થી<br>બેલદાર | ૬૪, હરીઓમ નગર, વિભાગ-૨, અમરોલી,<br>સુરત.<br>મો.નં. ૮૧૪૧૧ ૩૨૯૧૨.  | ડુંભાલ સ્ટોર<br>ખાતે ફરજ<br>બજાવે     |
| ૧૦૬ | શ્રી વિક્રમકુમાર જયેશભાઈ પટેલ<br>કર્મ નં. ૭૪૩૨૫    | તાલીમાર્થી<br>બેલદાર | ૨૮, કુંજગલી, પારસ પોલીસ થોકી સામે,<br>કતારગામ, સુરત. મો.નં. ૯૮૨૫૧ ૦૬૦૭૩                                  |                                       |
| ૧૦૭ | શ્રી વનરાજકુમાર વશવંતસિંહ ચૌહાણ<br>કર્મ નં. ૭૪૩૨૯  | તાલીમાર્થી<br>બેલદાર | બી-૩૩, પ્રભુદર્શન સોસાયટી, ઉગત, ભેંસાણ<br>રોડ, સુરત.<br>મો.નં. ૯૮૨૫૪ ૦૬૫૧૪                               |                                       |
| ૧૦૮ | શ્રી વિનેશકુમાર રજનીકાંતભાઈ પટેલ<br>કર્મ નં. ૭૪૩૩૫ | તાલીમાર્થી<br>બેલદાર | ૨૬-૬-૧૧૪, પ્રથમમાળ, "અંબાનિવાસ"<br>પ્રકાશ બેકરીસામે, રામનગર, રાંદેર રોડ,<br>સુરત.<br>મો.નં. ૯૯૨૫૯ ૧૦૧૧૯. |                                       |
| ૧૦૯ | શ્રી ભાવેશકુમાર કંચનભાઈ પટેલ<br>કર્મ નં. ૬૪૩૫૮     | તાલીમાર્થી<br>બેલદાર | સી-૯૦, રીવરપાર્ક સોસાયટી, સિંગણપોર<br>ગામ, કોઝવે, સુરત. મો.નં. ૯૦૯૯૧<br>૨૬૭૧૬.                           |                                       |
| ૧૧૦ | શ્રી જયેશકુમાર મહેશભાઈ નાયક,<br>કર્મ નં. ૪૯૯૦૩     | બેલદાર               | ૧૭૭, મહાદેવનગર કોલોની, હરિ ચંપા પાસે,<br>અડાજણ, સુરત-૩૯૫૦૦૯<br>મો.નં. ૯૫૧૦૧૪૩૩૩૫                         | સ્મીમેર<br>હોસ્પીટલ ખાતે<br>ફરજ બજાવે |



કલમ -૪(૧)(ખ)(૧૦) તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પધ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓને અને કર્મચારીઓને મળતા માસિક મહેનતાણા :-

| અ.નં. | અધિકારી/કર્મચારીનું નામ કર્મ.નંબર                       | હોદ્દો                                 | પગારઘોરણ                                       |
|-------|---|--|--|
| ૧     | શ્રીમતી ધ્વનિ નરેશભાઈ પટેલ,<br>કર્મ.નં.૩૬૪૫             | નાયબ આરોગ્ય<br>અધિકારીશ્રી (સર્વેલન્સ) | 8500-14000<br>15600-39100/5400<br>56100-177500 |
| ૨     | શ્રી ડા. કે. જી. વૈષ્ણવ, કર્મ.નં.૧૭૧૬૫                  | જંતુનાશક અધિકારી                       | 8000-13500<br>15600-39100/5400<br>56100-177500 |
| ૩     | શ્રી નરેશકુમાર ભોળાભાઈ સુથાર,<br>કર્મ.નં.૧૯૭૯૬          | એડીશનલ જંતુનાશક<br>અધિકારી             | 8000-13500<br>15600-39100/5400<br>56100-177500 |
| ૪     | શ્રી જયસુખલાલ પી. વાગડીયા,<br>કર્મ.નં. ૩૪૨૬૪            | એડીશનલ જંતુનાશક<br>અધિકારી             | 8000-13500<br>15600-39100/5400<br>56100-177500 |
| ૫     | શ્રી ગિરીશભાઈ શિવભાઈ કલાલ,<br>કર્મ.નં. ૭૬૮૩૮            | આસીસ્ટન્ટ જંતુનાશક<br>અધિકારી          | ON FIXED - 18500                               |
| ૬     | શ્રી નરેશભાઈ કંચનભાઈ વસાવા,<br>કર્મ.નં. ૭૬૮૪૧           | આસીસ્ટન્ટ જંતુનાશક<br>અધિકારી          | ON FIXED - 18500                               |
| ૫     | શ્રી સંજયકુમાર રમેશચંદ્ર મેવાવાલા,<br>કર્મ.નં.૧૮૭૬૦     | સેનેટરી ઈન્સપેક્ટર                     | 5500-9000<br>9300-34800/4400<br>39900-126600   |
| ૬     | શ્રી ધનસુખભાઈ મગનભાઈ આહીર,<br>કર્મ.નં.૧૯૬૬૪             | સેનેટરી ઈન્સપેક્ટર                     | -----"   |
| ૭     | શ્રી મેહુલ મનોજકુમાર દેસાઈ,<br>કર્મ.નં.૧૯૭૧૪            | સેનેટરી ઈન્સપેક્ટર                     | -----"   |
| ૮     | શ્રી મુકુલકુમાર છોટુભાઈ વશી<br>કર્મ. નં.૧૯૬૭૯           | સેનેટરી ઈન્સપેક્ટર                     | -----"   |
| ૯     | શ્રી કેયુષકુમાર હર્ષદરાય પટેલ<br>કર્મ. નં.૩૨૦૩૫         | સેનેટરી ઈન્સપેક્ટર                     | -----"   |
| ૧૦    | શ્રી રૂપલબેન ચેતન પંડયા<br>કર્મ. નં.૧૩૬૮૧               | લેબ. ટેકનીશ્યન                         | 8000-13500<br>9300-34800/5400<br>53100-167800  |
| ૧૧    | શ્રી કીર્તિદાબેન હેમતકુમાર ભાટપોરવાલા કર્મ.<br>નં.૧૯૩૯૭ | લેબ. ટેકનીશ્યન                         | -----"   |
| ૧૨    | શ્રી જાગૃતિબહેન વિકી જોષી<br>કર્મ. નં.૧૯૩૯૮             | લેબ. ટેકનીશ્યન                         | -----"   |
| ૧૩    | શ્રી પ્રાચી ગૌરાંગભાઈ વૈદ્ય, કર્મ નં.૧૯૩૯૯              | લેબ. ટેકનીશ્યન                         | -----"   |
| ૧૪    | શ્રી ચેતનભાઈ દેવશીભાઈ ચૌહાણ, કર્મ.<br>નં.૧૯૫૧૦          | લેબ. ટેકનીશ્યન                         | -----"   |
| ૧૫    | શ્રીમતી મનીષાબેન અલકેશભાઈ મહેતા,<br>કર્મ.નં.૧૯૭૪૫       | લેબ. ટેકનીશ્યન                         | -----"   |
| ૧૬    | શ્રી કેલાશબેન જયસુખલાલ કોઠીયા, કર્મ. નં.<br>૩૦૨૪૫       | લેબ. ટેકનીશ્યન                         | -----"   |
| ૧૭    | શ્રી ધ્રુતી રાજેશકુમાર વૈદ્ય, કર્મ. નં. ૩૨૦૬૩           | લેબ. ટેકનીશ્યન                         | 5000-8000<br>9300-34800/4200<br>35400-112400   |
| ૧૮    | શ્રી મનીષા કેતન દેસાઈ, કર્મ. નં. ૩૨૦૭૫                  | લેબ. ટેકનીશ્યન                         | -----"   |
| ૧૯    | શ્રી નિલમ્બરી સતિષકુમાર પરમાર, કર્મ. નં.<br>૩૪૦૧૯       | લેબ. ટેકનીશ્યન                         | 8000-13500<br>9300-34800/5400<br>53100-167800  |

|    |  |                        |  |
|----|--|------------------------|--|
| ૨૦ | શ્રી મેઘાબેન જીતિન રેશમવાલા<br>કર્મ. નં. ૩૪૭૮૩           | લેબ. ટેકનીશ્યન         | -----"-----                                  |
| ૨૧ | શ્રી ફાલ્ગુની ધર્મેશકુમાર દેસાઈ<br>કર્મ. નં. ૩૫૨૭૬       | લેબ. ટેકનીશ્યન         | 5000-8000<br>9300-34800/4200<br>35400-112400 |
| ૨૨ | શ્રી નેહા ધર્મેશકુમાર પટેલ, કર્મ. નં. ૩૫૨૮૮              | લેબ. ટેકનીશ્યન         | -----"-----                                  |
| ૨૩ | શ્રી નીતાબહેન હરીશભાઈ ચાવડા, કર્મ.<br>નં. ૩૫૫૫૧          | લેબ. ટેકનીશ્યન         | -----"-----                                  |
| ૨૪ | શ્રી સુમીત્રાબેન બકુલભાઈ ચોડવડીયા, કર્મ.<br>નં. ૩૮૨૭૬    | લેબ. ટેકનીશ્યન         | -----"-----                                  |
| ૨૫ | શ્રી મનીષાબેન તેજસ મોતીવાલા<br>કર્મ. નં. ૪૦૧૫૭           | લેબ. ટેકનીશ્યન         | -----"-----                                  |
| ૨૬ | શ્રી માનસી સાવનકુમાર પટેલ, કર્મ.<br>નં. ૪૦૧૫૮            | લેબ. ટેકનીશ્યન         | 4500-7000<br>5200-20200/2800<br>29200-92300  |
| ૨૭ | શ્રી રૂપલ પિયુષ ગજજર, કર્મ. નં. ૪૦૪૭૨                    | લેબ. ટેકનીશ્યન         | -----"-----                                  |
| ૨૮ | શ્રી ફાલ્ગુની સમીર પટેલ, કર્મ. નં. ૪૦૪૭૬                 | લેબ. ટેકનીશ્યન         | -----"-----                                  |
| ૨૯ | શ્રી બીનાબેન બાબુલાલ પટેલ,<br>કર્મ નં. ૭૪૨૧૪             | તા.લેબોરેટરી ટેકનીશીયન | ON FIXED - 17500                             |
| ૩૦ | શ્રી સુરભી ઘીરજલાલા કાકોલતરા<br>કર્મ નં. ૭૪૨૩૩           | તા.લેબોરેટરી ટેકનીશીયન | -----"-----                                  |
| ૩૧ | શ્રી પરેશ કે. ઠાકર , કર્મ નં. ૭૪૪૫૨                      | તા.લેબોરેટરી ટેકનીશીયન | -----"-----                                  |
| ૩૨ | શ્રી ચૈતાલીબહેન વિનોદકુમાર ટેલર<br>કર્મ નં. ૭૬૮૧૭        | તા.લેબોરેટરી ટેકનીશીયન | -----"-----                                  |
| ૩૩ | શ્રી રાજદિપસિંહ રતનસિંહ ખેર<br>કર્મ નં. ૭૬૮૧૮            | તા.લેબોરેટરી ટેકનીશીયન | -----"-----                                  |
| ૩૪ | શ્રી જયેશકુમાર હસમુખભાઈ નાયક, કર્મ.<br>નં. ૧૯૪૦૨         | સેનેટરી સબ ઈન્સ્પેક્ટર | 4500-7000<br>5200-20200/2800<br>29200-92300  |
| ૩૫ | શ્રી સુનિલ બી. પટેલ, કર્મ. નં. ૩૪૪૪૪                     | સેનેટરી સબ ઈન્સ્પેક્ટર | -----"-----                                  |
| ૩૬ | શ્રી વિપુલકુમાર મનહરલાલ સોલંકી, કર્મ. નં.<br>૩૯૩૦૪       | સેનેટરી સબ ઈન્સ્પેક્ટર | -----"-----                                  |
| ૩૭ | શ્રી કલ્પેશકુમાર કાંતિલાલ પટેલ<br>કર્મ. નં. ૪૭૬૩૧        | ત્રીજી શ્રેણી કલાર્ક   | 3050-4590<br>5200-20200/1900<br>19900-63200  |
| ૩૮ | શ્રીમતી કુસુમબેન મહેશભાઈ પટેલ, કર્મ. નં.<br>૪૭૬૩૨        | ત્રીજી શ્રેણી કલાર્ક   | -----"-----                                  |
| ૩૯ | શ્રી પ્રણેશકુમાર જીતેન્દ્રભાઈ સોલંકી, કર્મ.<br>નં. ૪૭૮૭૧ | ત્રીજી શ્રેણી કલાર્ક   | -----"-----                                  |
| ૪૦ | શ્રી ભાવિનકુમાર વિનોદચંદ્ર પંચાલ, કર્મ.<br>નં. ૪૮૦૦૫     | ત્રીજી શ્રેણી કલાર્ક   | -----"-----                                  |
| ૪૧ | શ્રી વિજયકુમાર લક્ષ્મીદાસ ટાંક<br>કર્મ. નં. ૪૮૨૦૮        | ત્રીજી શ્રેણી કલાર્ક   | -----"-----                                  |
| ૪૨ | શ્રીમતી તન્વીબેન વિજયસિંહ ઠાકોર, કર્મ.<br>નં. ૪૮૧૫૫      | ત્રીજી શ્રેણી કલાર્ક   | -----"-----                                  |
| ૪૩ | શ્રી રમેશકુમાર રામશંકર ત્રિવેદી<br>કર્મ. નં. ૩૪૦૫૭       | ડ્રાયવર                | 4500-7000<br>5200-20200/2800<br>29200-92300  |
| ૪૪ | શ્રી જયેશકુમાર શાંતિલાલ પવાર<br>કર્મ. નં. ૪૦૫૫૨          | ડ્રાયવર                | 3050-4590<br>5200-20200/1900<br>19900-63200  |
| ૪૫ | શ્રી ઈશ્વરલાલ જયંતિલાલ પટેલ, કર્મ.<br>નં. ૪૦૮૮૦          | ડ્રાયવર                | -----"-----                                  |
| ૪૬ | શ્રી પ્રકાશકુમાર સુમંતરાય રાવલ, કર્મ.<br>નં. ૧૯૪૪૯       | પ્રા.હ. વ.             | 5000-8000<br>9300-34800/4200                 |

|    |   |              |   |
|----|---|--------------|---|
|    |   |              | 35400-112400                                |
| ૪૭ | શ્રી શૈલેન્દ્રકુમાર છોટાલાલ વાડીવાલા, કર્મ.<br>નં.૧૯૪૭૩ | પ્રા. હે. વ. | -----"-----                                 |
| ૪૮ | શ્રી રવિન્દ્રકુમાર મોહનલાલ પટેલ, કર્મ.<br>નં.૧૯૮૬૫      | પ્રા. હે. વ. |   |
| ૪૯ | શ્રી કમલેશકુમાર ઈશ્વરભાઈ ઢીમ્મર,<br>કર્મ.નં.૩૪૩૯૬       | પ્રા. હે. વ. | -----"-----                                 |
| ૫૦ | શ્રી પ્રવિણસિંહ ભીખુસિંહ પરમાર, કર્મ.<br>નં.૩૪૪૩૧       | પ્રા. હે. વ. | -----"-----                                 |
| ૫૧ | શ્રી અજીત પાનીયાભાઈ ગામીત<br>કર્મ. નં. ૩૪૪૩૪            | પ્રા. હે. વ. | -----"-----                                 |
| ૫૨ | શ્રી મોહમદઆરીફ જી. મન્સુરી<br>કર્મ. નં. ૩૪૪૩૫           | પ્રા. હે. વ. | -----"-----                                 |
| ૫૩ | શ્રી સુનિલભાઈ ખુશાલભાઈ પટેલ, કર્મ. નં.<br>૩૪૪૫૬         | પ્રા. હે. વ. | -----"-----                                 |
| ૫૪ | શ્રી જેમ્સ જોન મેકવાન<br>કર્મ. નં. ૩૪૪૬૦                | પ્રા. હે. વ. | 4000-6000<br>5200-20200/2400<br>25500-81100 |
| ૫૫ | શ્રી સંદિપકુમાર શરદભાઈ નાયક,<br>કર્મ. નં.૩૪૬૫૨          | પ્રા. હે. વ. | -----"-----                                 |
| ૫૬ | શ્રી કૌશિકભાઈ જગદીશભાઈ દેસાઈ, કર્મ.<br>નં.૩૪૮૫૨         | પ્રા. હે. વ. | -----"-----                                 |
| ૫૭ | શ્રીમતી સેજલ સુનિલકુમાર પટેલ,<br>કર્મ. નં.૪૦૪૯૪         | પ્રા.હે.વ    | 3050-4590<br>5200-20200/1900<br>19900-63200 |
| ૫૮ | શ્રી ચેતન પ્રકાશ મહાજન, કર્મ. નં.૪૫૮૬૩                  | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૫૯ | શ્રી બ્રિજેશકુમાર અશોકભાઈ ગામીત, કર્મ.<br>નં.૪૫૯૩૭      | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૬૦ | શ્રી સતિશભાઈ પ્રતાપભાઈ પરમાર, કર્મ.<br>નં.૪૫૯૩૮         | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૬૧ | શ્રી સુરસિંહ જવાનસિંહ સોલંકી<br>કર્મ. નં. ૪૫૯૩૯         | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૬૨ | શ્રી હર્ષદભાઈ ઘીરુભાઈ મકવાણા, કર્મ. નં.<br>૪૫૯૪૧        | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૬૩ | શ્રી મુકેશભાઈ અર્જુનભાઈ પગી<br>કર્મ. નં. ૪૫૯૪૨          | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૬૪ | શ્રી ભારતીબેન નિતિનકુમાર સોલંકી, કર્મ. નં.<br>૪૫૯૪૪     | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૬૫ | શ્રી વિપુલભાઈ મકોડભાઈ જોષી, કર્મ.<br>નં.૪૫૯૪૫           | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૬૬ | શ્રી પંકિતકુમાર શરદભાઈ નાયક,<br>કર્મ.નં.૪૮૫૨૫           | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૬૭ | શ્રી તેજશકુમાર રમણભાઈ ટંડેલ<br>કર્મ. નં. ૪૮૫૪૦          | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૬૮ | શ્રી હિરણકુમાર અર્જુનસિંહ ઠાકોર, કર્મ.<br>નં.૪૮૫૪૧      | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૬૯ | શ્રી સહદેવ અંબાલાલ પઢીયાર<br>કર્મ. નં.૪૮૫૪૨             | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૭૦ | શ્રી રોબિનકુમાર રમેશભાઈ પટેલ,<br>કર્મ.નં.૪૮૫૪૩          | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૭૧ | શ્રી ઉર્મિલાબેન નરેન્દ્રકુમાર પરમાર, કર્મ.નં.<br>૪૮૫૪૪  | પ્રા.હે. વ.  | -----"-----                                 |
| ૭૨ | શ્રી અંકિતભાઈ ચીમનભાઈ મહેતા<br>કર્મ.નં.૪૮૫૪૫            | પ્રા.હે. વ.  | -----"-----                                 |

|    |   |             |   |
|----|---|-------------|---|
| ૭૩ | શ્રી ઘર્મન્દ્રકુમાર નરેન્દ્રભાઈ જોષી,<br>કર્મ.નં. ૪૮૫૪૬ | પ્રા.હે. વ. | -----"-----                                 |
| ૭૪ | શ્રી શેલેષભાઈ વીસાભાઈ યુડાસમા,<br>કર્મ.નં. ૪૮૫૪૭        | પ્રા.હે. વ. | -----"-----                                 |
| ૭૫ | શ્રી સૌરભ વિનોદભાઈ પટેલ<br>કર્મ.નં. ૪૮૫૪૮               | પ્રા.હે. વ. | -----"-----                                 |
| ૭૬ | શ્રી માલદે વજરાંગભાઈ વાઢીયા<br>કર્મ.નં. ૪૮૫૪૯           | પ્રા.હે. વ. | -----"-----                                 |
| ૭૭ | શ્રી ભરતકુમાર શાંતિલાલ નાઈ<br>કર્મ.નં. ૪૮૫૮૬            | પ્રા.હે. વ. | -----"-----                                 |
| ૭૮ | શ્રી દિવ્યેશકુમાર ભરતભાઈ પટેલ,<br>કર્મ.નં. ૮૮૮૯૨        | પટાવાળા     | 2650-4000<br>4440-7440/1650<br>1500-81100   |
| ૭૯ | શ્રી અરૂણ ગોવિંદભાઈ શર્મા<br>કર્મ.નં. ૧૪૦૨૮             | બેલદાર      | 4000-6000<br>5200-20200/2400<br>25500-81100 |
| ૮૦ | શ્રી નરેશભાઈ ચીમનલાલ વૈદ્ય<br>કર્મ.નં. ૧૪૦૭૮            | બેલદાર      | -----"-----                                 |
| ૮૧ | શ્રી અશ્વિનકુમાર નટવરલાલ પટેલ,<br>કર્મ.નં. ૧૭૬૮૮        | બેલદાર      | -----"-----                                 |
| ૮૨ | શ્રી રણજીતભાઈ રવિયાભાઈ પટેલ,<br>કર્મ.નં. ૧૮૬૯૧          | બેલદાર      | -----"-----                                 |
| ૮૩ | શ્રી વિનોદભાઈ રૂડાભાઈ વીરાસ, કર્મ.નં.<br>૩૪૧૦૮          | બેલદાર      | 4000-6000<br>5200-20200/2400<br>25500-81100 |
| ૮૪ | શ્રી નીતીનભાઈ મુળજીભાઈ હરીજન, કર્મ.નં.<br>૩૮૦૪૧         | બેલદાર      | 3050-4590<br>5200-20200/1900<br>19900-63200 |
| ૮૫ | શ્રી અમિતકુમાર દલસુખભાઈ વાઘેલા,<br>કર્મ.નં. ૩૮૧૦૫       | બેલદાર      | 2650-4000<br>4440-7440/1650<br>15700-50000  |
| ૮૬ | શ્રી વિનોદ ડાહ્યાભાઈ બારોટ<br>કર્મ.નં. ૩૯૫૦૨            | બેલદાર      | 3050-4590<br>5200-20200/1900<br>19900-63200 |
| ૮૭ | શ્રી અજયકુમાર ચંપકલાલ ટેન્યા<br>કર્મ.નં. ૪૨૭૨૫          | બેલદાર      | 2650-4000<br>4440-7440/1650<br>15700-50000  |
| ૮૮ | શ્રી દર્શવકુમાર રમણીકભાઈ રંગાણી. કર્મ નં.<br>૬૦૩૮૪      | બેલદાર      | -----"-----                                 |
| ૮૯ | શ્રી ભાવેશ રમેશચંદ્ર અજમેરી<br>કર્મ નં. ૬૦૪૨૭           | બેલદાર      | -----"-----                                 |
| ૯૦ | શ્રી અવિનાશ શિવાજી પાટીલ<br>કર્મ નં. ૬૦૪૪૬              | બેલદાર      | -----"-----                                 |
| ૯૧ | શ્રી પંકજભાઈ નરસિંહભાઈ પટેલ કર્મ નં.<br>૬૦૪૫૨           | બેલદાર      | -----"-----                                 |
| ૯૨ | શ્રી સુનીલ રઘુનાથ પવાર<br>કર્મ નં. ૬૦૪૬૨                | બેલદાર      | -----"-----                                 |
| ૯૩ | શ્રી વૃષાકકુમાર વિજયકુમાર ખરસાડીયા, કર્મ<br>નં. ૬૦૪૭૨   | બેલદાર      | -----"-----                                 |
| ૯૪ | શ્રી વિશાલકુમાર ધનરાજભાઈ પટેલ, કર્મ નં.<br>૬૦૪૭૬        | બેલદાર      | -----"-----                                 |
| ૯૫ | શ્રી પ્રશાંતકુમાર ગૌતમભાઈ શિંદે કર્મ નં.<br>૬૨૮૬૧       | બેલદાર      | -----"-----                                 |
| ૯૬ | શ્રી સાગર મધુકર પાનપાટીલ<br>કર્મ નં. ૬૨૮૬૪              | બેલદાર      | -----"-----                                 |

|     |  |                   |  |
|-----|--|-------------------|--|
| ૯૭  | મોહમદ કાસિમ અખત્યારહુસેન કાદીર કર્મ નં.<br>૬૨૮૬૫   | બેલદાર            | -----"-----                                |
| ૯૮  | શ્રી અબ્દુલસાજીદ અઝીઝ શેખ<br>કર્મ નં. ૬૨૮૬૯        | બેલદાર            | -----"-----                                |
| ૯૯  | શ્રી પ્રિયાંશુ યોગેશ મોરે<br>કર્મ નં. ૬૩૧૩૭        | બેલદાર            | -----"-----                                |
| ૧૦૦ | શ્રી અનિલ અમરસીંગ વસાવા<br>કર્મ નં. ૭૪૩૦૫          | તાલીમાર્થી બેલદાર | ON FIXED - 15500                           |
| ૧૦૧ | શ્રી આકાશ નરેશભાઈ પટેલ<br>કર્મ નં. ૭૪૩૦૯           | તાલીમાર્થી બેલદાર | -----"-----                                |
| ૧૦૨ | શ્રી મેઘાબેન શૈલેષકુમાર પટેલ<br>કર્મ નં. ૭૪૩૧૪     | તાલીમાર્થી બેલદાર | -----"-----                                |
| ૧૦૩ | શ્રી હેતલબેન ચંદ્રકાંતભાઈ પટેલ<br>કર્મ નં. ૭૪૩૧૭   | તાલીમાર્થી બેલદાર | -----"-----                                |
| ૧૦૪ | શ્રી જીગ્નેશ દિનેશકુમાર પરમાર<br>કર્મ નં. ૭૪૩૨૧    | તાલીમાર્થી બેલદાર | -----"-----                                |
| ૧૦૫ | શ્રી સંજયકુમાર ધીરુભાઈ વાઘેલા<br>કર્મ નં. ૭૪૩૨૪    | તાલીમાર્થી બેલદાર | -----"-----                                |
| ૧૦૬ | શ્રી વિક્રમકુમાર જયેશભાઈ પટેલ<br>કર્મ નં. ૭૪૩૨૫    | તાલીમાર્થી બેલદાર | -----"-----                                |
| ૧૦૭ | શ્રી વનરાજકુમાર વશવંતસિંહ ચૌહાણ<br>કર્મ નં. ૭૪૩૨૯  | તાલીમાર્થી બેલદાર | -----"-----                                |
| ૧૦૮ | શ્રી વિનેશકુમાર રજનીકાંતભાઈ પટેલ<br>કર્મ નં. ૭૪૩૩૫ | તાલીમાર્થી બેલદાર | -----"-----                                |
| ૧૦૯ | શ્રી ભાવેશકુમાર કંચનભાઈ પટેલ<br>કર્મ નં. ૬૪૩૫૮     | તાલીમાર્થી બેલદાર | -----"-----                                |
| ૧૧૦ | શ્રી જયેશકુમાર મહેશભાઈ નાયકા,<br>કર્મ નં. ૪૯૯૦૩    | બેલદાર            | 2650-4000<br>4440-7440/1650<br>15700-50000 |

**કલમ -૪(૧)(ખ)(૧૧)**

તમામ યોજનાઓ સુચિત ખર્ચ, ચુકવેલ નાણા પરના અહેવાલોની વિગતો દર્શાવતુ અંદાજપત્ર :-

બી.સી.એન.ટી. વાઈઝ અધિકારી અને કર્મચારીઓની માહિતી [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) પર સયુંકત રીતે મુકવામાં આવેલ છે

**કલમ -૪(૧)(ખ)(૧૨)**

ફાળવેલ રકમો સહિત સબસીડી કાર્યકરોની અમલ બજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો :-

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે અત્રેના ખાતાની અલાયદી માહિતી નથી.

**કલમ -૪(૧)(ખ)(૧૩)**

તેણે આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવારાની વિગતો :-

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે અત્રેના ખાતાની અલાયદી માહિતી નથી.

**કલમ -૪(૧)(ખ)(૧૪)**

ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતીઓને લગતી વિગતો :-

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે

**કલમ -૪(૧)(ખ)(૧૫)**

જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તો તેવા ગ્રંથાલયની અથવા તેના વાંચનકક્ષના કામકાજનાં કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગત :-

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે

**કલમ -૪(૧)(ખ)(૧૬)**

જાહેર માહિતી અધિકારીઓનાં નામો, હોદ્દા અને બીજી વિગતો :-

સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ [www.suratmunicipal.gov.in](http://www.suratmunicipal.gov.in) પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે

**કલમ -૪(૧)(ખ)(૧૭)**

ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :-

સુરત મહાનગરપાલિકામાં જાહેર સત્તામંડળ સાથે સંયુક્ત છે

- (૧) જુલાઈ થી સપ્ટેમ્બર - ૨૦૨૩ રજીસ્ટર નમુનો - ૧
- (૨) ઓક્ટોબર થી ડિસેમ્બર - ૨૦૨૩ રજીસ્ટર નમુનો - ૧
- (૩) જાન્યુ થી માર્ચ - ૨૦૨૪ રજીસ્ટર નમુનો - ૧
- (૪) એપ્રિલ થી મે - ૨૦૨૪ રજીસ્ટર નમુનો - ૧

જંતુનાશક અધિકારી  
વી.બી.ડી.સી વિભાગ  
સુરત મહાનગરપાલિકા

## એનેક્ષર-એ

### પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી વડી કચેરી(પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો (પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર) (પી.એ.ડી.) તૈયાર કરવામાં આવી છે, અને તા.૦૧-૦૫-૨૦૨૪ ની સ્થિતિએ તે અદ્યતન કરવામાં આવેલ છે, જેનું અમારા દ્વારા માહે મે/જુન-૨૦૨૪ દરમ્યાન ઈન્સ્પેક્શન-કમ-ઓડીટ કરવામાં આવ્યું છે, અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગર તો અપૂરતી વિગતો જણાઈ હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.

તા.૩૦-૦૬-૨૦૨૪ ની સ્થિતિએ હવે કોઈ જાહેર સત્તામંડળોના પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર(પી.એ.ડી.)નું ઈન્સ્પેક્શન-કમ-ઓડીટ બાકી રહેલ નથી.

ડે.કમિશનર(હે. અને હો.)  
સુરત મહાનગરપાલિકા

સાદર રજુ,

ડે. મ્યુ.કમિશનર અને નોડલ ઓફિસર, રાઈટ ટુ ઈન્ફોર્મેશન સેલના નાં પત્ર નં.આરટીઆઈ સેલ/૩૪, તા.૨૧૧/૦૬/૨૦૨૪ અન્વયે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ-૪ મુજબ વી.બી.ડી.સી. વિભાગના પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝરના ઓડીટ-કમ-ઈન્સ્પેક્શનની તા.૦૧-૫-૨૦૨૪ ની સ્થિતિએ અદ્યતન કરેલ માહિતી આ સાથે સામેલ છે. જે માહિતી આઈ.એસ.ડી. વિભાગમાં એન્ટ્રી કરવા ડેપ્યુટી કમિશનરશ્રી(હે. અને હો.)મારફત એકઝીક્યુટીવ આસીસ્ટન્ટશ્રી આઈ.એસ.ડી પ્રતિ લખાઈ જવા વિનંતી. આ સાથે હાર્ડકોપી અને સોફ્ટકોપી સામેલ છે.

ત્રીજી શ્રેણી કલાર્ક  
વી.બી.ડી.સી વિભાગ

સેક્શન ઓફિસરશ્રી

એડીશનલ જંતુનાશક અધિકારીશ્રી

જંતુનાશક અધિકારીશ્રી

નાયબ આરોગ્ય અધિકારીશ્રી (સર્વેલન્સ)

આરોગ્ય અધિકારીશ્રી

ડેપ્યુટી કમિશનરશ્રી(હે. અને હો.)  
સુરત મહાનગરપાલિકા



સ.ર. ઈ.ચા. ડાયરેક્ટરશ્રી (IT) પ્રતિ,

ડે. મ્યુ.કમિશનર અને નોડલ ઓફિસર, રાઈટ ટુ ઈન્ફોર્મેશન સેલના નાં પત્ર નં.આરટીઆઈ સેલ/૧૨, તા.૨૭/૦૪/૨૦૨૩ અન્વયે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ-૪ મુજબની પ્રો એક્ટીવ ડીસ્ક્લોઝર અંગે વીબીડીસીડીની વિગતો દર્શાવતી માહિતી તથા ડે.કમિશનરશ્રીના પત્ર નં. એસએમસી/આઈ.એસ.ડી/૩૧૪ તા.૪/૬/૧૬ મુજબ વેબસાઈટ પર માહિતી અદ્યતન હોવા બાબતનું પ્રમાણપત્ર આ સાથે સામેલ છે. જે આપશ્રીની જાણ માટે.

નં.પીએચડી/આઈઓ/  
તારીખ:-

જંતુનાશક અધિકારી  
વી.બી.ડી.સી વિભાગ  
સુરત મહાનગરપાલિકા

સ.ર. ઈ.ચા. ડાયરેક્ટરશ્રી (IT) પ્રતિ,

ડે. મ્યુ.કમિશનર અને નોડલ ઓફિસર, રાઈટ ટુ ઈન્ફોર્મેશન સેલના નાં પત્ર નં.આરટીઆઈ સેલ/૧૨, તા.૨૭/૦૪/૨૦૨૩ અન્વયે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ-૪ મુજબની પ્રો એક્ટીવ ડીસ્ક્લોઝર અંગે વીબીડીસીડીની વિગતો દર્શાવતી માહિતી તથા ડે.કમિશનરશ્રીના પત્ર નં. એસએમસી/આઈ.એસ.ડી/૩૧૪ તા.૪/૬/૧૬ મુજબ વેબસાઈટ પર માહિતી અદ્યતન હોવા બાબતનું પ્રમાણપત્ર આ સાથે સામેલ છે. જે આપશ્રીની જાણ માટે.

નં.પીએચડી/આઈઓ/  
તારીખ:-

જંતુનાશક અધિકારી  
વી.બી.ડી.સી વિભાગ  
સુરત મહાનગરપાલિકા

સ.ર. સેકશન ઓફિસરશ્રી (રાઈટ ટુ ઈન્ફોર્મેશન સેલ) પ્રતિ

સવિનય જણાવવાનું કે, ડે.મ્યુનિ.કમિશનરશ્રી અને નોડલ ઓફિસરશ્રી પત્ર નં.આરટીઆઈ સેલ/૧૩, તા.૨૬/૦૪/૨૦૨૩ અન્વયે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ-૪ મુજબની પ્રો એક્ટીવ ડીસ્ક્લોઝર અંગે વીબીડીસીડીની વિગતો દર્શાવતી માહિતી તથા ડે.કમિશનરશ્રીના પત્ર નં. એસએમસી/આઈ.એસ.ડી/૩૧૪ તા.૪/૬/૧૬ મુજબ વેબસાઈટ પર માહિતી અદ્યતન હોવા બાબતનું પ્રમાણપત્ર આ સાથે સામેલ છે. જે આપશ્રીની જાણ માટે.

નં.પીએચડી/આઈઓ/  
તારીખ:-

જંતુનાશક અધિકારી  
વી.બી.ડી.સી વિભાગ  
સુરત મહાનગરપાલિકા

સ.ર.સેકશન ઓફિસરશ્રી (રાઈટ ટુ ઈન્ફોર્મેશન સેલ) પ્રતિ

સવિનય જણાવવાનું કે, ડે.મ્યુનિ.કમિશનરશ્રી અને નોડલ ઓફિસરશ્રી પત્ર નં.આરટીઆઈ સેલ/૧૩, તા.૨૬/૦૪/૨૦૨૩ અન્વયે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ની કલમ-૪ મુજબની પ્રો એક્ટીવ ડીસ્ક્લોઝર અંગે વીબીડીસીડીની વિગતો દર્શાવતી માહિતી તથા ડે.કમિશનરશ્રીના પત્ર નં. એસએમસી/આઈ.એસ.ડી/૩૧૪ તા.૪/૬/૧૬ મુજબ વેબસાઈટ પર માહિતી અદ્યતન હોવા બાબતનું પ્રમાણપત્ર આ સાથે સામેલ છે. જે આપશ્રીની જાણ માટે.

નં.પીએચડી/આઈઓ/

જંતુનાશક અધિકારી

तारीख:-

वी.बी.डी.सी विभाग  
सुरत महानगरपालिका